

---

# ફુલ પાણી



# ૧. દેશી ગુલાબ

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કૃ. થ્ય., જૂનાગઢ)

ગુલાબ એ ગ્રીક માન્યતા પ્રમાણે પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. ગુલાબ આજે વિશ્વમાં પ્રથમ નંબરનું લોકપ્રિય ફૂલ છે. સેંકડો વર્ષોના કુદરતી સંકરણ અને મ્યુટેશન દ્વારા આજે ગાઢા ભૂરાં અને ગાઢા કાળાં રેંગ સિવાયના બધા જ રંગોના ગુલાબના ફૂલો જોવા મળે છે. તેના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજા-પાઠ, હાર બનાવવા, શણગાર તથા ફૂલોની હેરો બનાવવા, કલગી/બુકે વગેરે બનાવવા માટે થાય છે. ગુલાબની પાંદડીઓમાંથી ગુલાબ અત્તર, ગુલાબજળ, ગુલકંદ વગેરે બનાવી શકાય છે. શીત કટિબંધમાં ગુલાબ વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને ત્યાં તે સુષ્પ્લ અવસ્થામાં આરામ પણ મેળવી શકે છે પરંતુ આ પ્રકારનું હવામાન આપણે ત્યાં મળતું નહીં હોવાથી આપણે ત્યાં તેની છાંટણી કરવી પડે છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ઝેડા, નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓમાં લગભગ ૩૮૭૮ હેકટર જેટલા વિસ્તારમાં દેશી ગુલાબની એતી વ્યાપારિક ધોરણે થાય છે, જેનો વાવેતર વિસ્તાર આણંદ જિલ્લાના ફક્ત કુંજરાવ ગામમાં આશરે ૧૫૦ થી ૨૦૦ વિધા જેટલો થાય છે, જે દેશી ગુલાબનો મુખ્ય પોકેટ વિસ્તાર ગણાય છે. ત્યાંના ઝેડ્રો મધ્યરાત્રિએ ચાજોબલ બેટરી દ્વારા ગુલાબની ખીલતી કળીઓ ઉતારીને વહેલી સવારે એક જગ્યાએ એકત્ર કરીને સામૂહિક વેચાણ અથે ટેપ્સા દ્વારા અમદાવાદ ખાતેના સરદાર માર્કેટ પાસેના ફૂલબજારમાં આખા વર્ષ દરમ્યાન ઓછાવત્તા પ્રમાણમાં વેચાણ અથે મોકલે છે અને સારી એવી આવક મેળવે છે.

## હવામાન

દેશી ગુલાબના પાકને ઠંડુ અને સુંકું હવામાન વધુ માફક આવે છે. તેના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળવો આવશ્યક છે. જો કે ગરમ અને બેજવાળા વાતાવરણમાં પણ તેનો ઉછેર કરી શકાય છે, પરંતુ આવા વાતાવરણમાં રોગ-જીવાતનું પ્રમાણ સૂક્ષ્મ વિસ્તાર કરતાં વિશેષ રહે છે. દિવસ દરમ્યાન ૬ થી ૮ કલાક સૂર્યપ્રકાશ મળી રહે તો છોડની વૃદ્ધિ સારી થાય છે. છાંચો તથા ભારે પવન અનુકૂળ આવતાં નથી.

## જમીન

ગુલાબના છોડને મોટાભાગે દરેક પ્રકારની જમીન માફક આવે છે પરંતુ ગોરાડું, મધ્યમ કાળી, ફળકૂપ અને સારી નિતારશક્તિ ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. જો જમીન રેતાળ હોય તો જમીનમાં સેન્ટ્રિય ખાતરો વધુ પ્રમાણમાં ઉમેરવા. ગુલાબના છોડને ખારાશવાળી જમીન અનુકૂળ આવતી નથી. ભારે કાળી જમીનમાં સેન્ટ્રિય ખાતરો ઉમેરીને નિતારશક્તિ સુધારીને ઉપયોગ થઈ શકે છે.

## સ્થળની પસંદગી

ગુલાબની એતી માટે જયાં વધુ પ્રમાણમાં સૂર્યપ્રકાશ આવતો હોય તેવી જમીનનું સ્થળ પસંદ કરવું. આ ઉપરાંત વૃક્ષો, વાડ કે દિવાલથી દૂર અને દિવસ દરમ્યાન ઓછામાં ઓછો ૬ કલાક સૂર્યનો તડકો મળી રહે તેવી જમીનનું સ્થળ પસંદ કરવાથી સારી ગુણવત્તાવાળા ફૂલો વધુ પ્રમાણમાં મળી રહે છે.

## છોડની રોપણી માટે ખાડા તૈયાર કરવા

ગુલાબને વધુ સૂર્યપ્રકાશ જરૂરી હોવાથી ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ. દેશી ગુલાબના છોડ રોપવા માટે ઉનાળામાં ૫૦ સે.મી. × ૫૦ સે.મી. × ૫૦ સે.મી. માપના ખાડા એતરમાં ખોદવા તેમજ તે ખોદેલ ખાડાની માટીને ૧૫ થી ૨૦ દિવસ સુધી સૂર્યના તડકામાં તપવા દેવા. ખોદેલ માટીમાં જૂન-જુલાઈ માસમાં ૮ થી ૧૦ કિ.ગ્રા. સારું કોહવાયેલું છાણીયું

ખાતર અથવા ૨૦૦ ગ્રામ દિવેલીનો ખોળ લેજવવો.

### પ્રસર્જન

દેશી ગુલાબનું સંવર્ધન કટકા કલમ અને ગુટી કલમથી કરવામાં આવે છે. આ પદ્ધતિ સરળ અને સસ્તી છે.

### રોપણી સમય અને રોપણી અંતર

ગુજરાતમાં દેશી ગુલાબની રોપણી માટે જૂન-જુલાઈ માસ વધુ અનુકૂળ છે. ભારે વરસાદ પડી ગયા બાદ છોડની રોપણી કરવી જોઈએ. જો વધુ ભારે વરસાદ ચાલુ રહેતો હોય તો સપ્ટેમ્બર થી નવેમ્બર માસ સુધી રોપણી કરી શકાય છે. પરંતુ ચોમાસામાં કરેલ રોપણીની સરખામણીમાં ફૂલો પ્રથમ વર્ષે ઓછા ઉત્તરે છે. ગુજરાતમાં દેશી ગુલાબનું વાવેતર ૬૦ સે.મી. × ૬૦ સે.મી. અથવા ૧૫૦ સે.મી. × ૬૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. ગુલાબનું વાવેતર પહોળા અંતરે કરવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી મળતી હોવાથી ફૂલોનું ઉત્પાદન ઓછું મળે છે. છોડની રોપણી માટે અગાઉથી તૈયાર કરેલ ખાડાની મધ્યમાં દેશી ગુલાબની કલમો રોપવી જેના માટે પ્લાસ્ટિક બેગ જેટલી જગ્યાનો ખાડો કરવો અને ત્યારબાદ મૂળને ઈજા ન થાય તે પ્રમાણે કાળજીપૂર્વક પ્લાસ્ટિક બેગ કાપીને મારીનો પિંડ તૂટે નહિ તે પ્રમાણે છોડને ખાડામાં રોપવો અને ખાડામાં મારી નાખીને બરાબર દબાવવી અને તરત જ પાણી આપવું. જરૂરી જણાય તો છોડને ટેકા આપવા જોઈએ.

### ખાતર

દેશી ગુલાબના છોડનું વધુ ઉત્પાદન મેળવવા તેમજ સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા માટે છોડની રોપણી બાદ વર્ષમાં ત્રણ વખત સપ્રમાણ (જૂન, ઓક્ટોબર અને જાન્યુઆરી)માં ખાતરો આપવા જોઈએ. જેમાં દર વર્ષ છોડ દીઠ રીતે ૩ થી ૪ કિ.ગ્રા. છાણીયું ખાતર જમીનમાં આપવું. આણંદ ખાતે થયેલ ભલામણ મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ ઉમરના દેશી લાલ ગુલાબ પાકને છોડ દીઠ ૧ મી.લી. એઝોસ્પિરીલમ તથા ૧ મી.લી. પી.એસ.બી. ૨૦૦ મી.લી. પાણીમાં મિશ્રણ કરીને ત્રણ સરખા ભાગે જમીનમાં આપવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. લીલા પડવાશ તરીકે શાણ અથવા ઇક્કડનું વાવેતર કરવું.

### છાંટણી

દેશી ગુલાબમાં છાંટણી એક વર્ષ કે વધુ ઉમરના જૂના છોડની કરવામાં આવે છે. ગુજરાતમાં ઓક્ટોબર માસનું બીજુ પખવાઈયું છાંટણી માટે વધુ અનુકૂળ છે. એક વર્ષ જૂની સારી ડાળીઓને ૪ થી ૬ સારી આંખો રાખીને છાંટણી કરવી. સામાન્ય રીતે છાંટણી જમીનની સપાટીથી ૪૫ થી ૬૦ સે.મી. ઉંચાઈએ કરવી. છાંટણી કર્યા બાદ ૪૫ થી ૫૦ દિવસે છોડ ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. વારંવાર છાંટણી કરવાથી છોડ નબળો પડે છે.

### પિયત

દેશી ગુલાબને પાણીની જરૂરિયાત ઋતુ અને જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. ઘેતરમાં નવી રોપેલ કલમ/છોડને શરૂઆતમાં એક અઠવાડીયા સુધી દરરોજ લેજ જળવાઈ રહે તેટલું પાણી આપવું. ત્યારબાદ શિયાળામાં ૮ થી ૧૦ અને ઉનાળામાં ૪ થી ૮ દિવસે પિયત આપવું અને ચોમાસામાં જરૂર જણાય તો જ પાણી આપવું. શક્ય હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ (ડ્રિપ ઇરિગેશન)નો ઉપયોગ કરવો જોઈએ.

### નિદામણ અને આંતરખેડ

પિયત આપ્યા બાદ વરાપ થયા પછી જરૂર મુજબ કરબડી અથવા કોંદાળી વડે ગોડ કરવો. છોડના થડની વધુ નજીક બહુ ઉંડેથી ગોડ કરવો નહીં. ગુલાબમાં નિયમિત છોડના ખામણાંમાં ઉગેલુ નીદાણ તથા નવા પીલા દૂર કરતાં રહેવું. ગુલાબના પાકમાં નીદાણ નહિવત્ત હોય છે જેથી દાતરડી કે ખુરપી વડે ઘાસ કાઢતાં રહેવું.

### અન્ય કાળજી

દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ઋતુમાં માર્ચ-એપ્રિલ માસમાં ફૂલો ઉતારી લીધા પછી આંબા કે આસોપાલવના સૂકાં પાંદડા અથવા ડાંગરના ફોતરાંનું આચાદન છોડની આજુબાજુ પાથરવાથી ભેજનો સંગ્રહ થાય છે તેમજ નીદાણની

---

વૃદ્ધિ અટકાવી શકાય છે. આણંદ ખાતે થયેલ સંશોધન મુજબ દેશી ગુલાબના પાકમાં ઉનાળાની ઝતુમાં (માર્ચ-મે) ડાંગરના ફોટરાનું આચ્છાદન છોડની આજુબાજુ ૫ સે.મી. જાડાઈનો થર કરવાથી ફૂલોનું વધુ ઉત્પાદન મળે છે. ગુલાબના છોડ ઉપરથી સૂક્ષ્માયેલ, રોગ કે જીવાતથી નુકશાન પામેલી આડી-અવળી ફેલાતી ડાળીઓ કે નડતરરૂપ ડાળીઓને દૂર કરવી જોઈએ.

### પાક સંરક્ષણ

દેશી ગુલાબના છોડ ઉપર મુખ્ય જીવાતોમાં મોલો-મશી, શ્રીપસ, તડતડિયાં, ભીંગડાવાળી જીવાત, માઈટસ જેવી ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે. જના નિયંત્રણ માટે ઐતરમાં રહેલ વધારાનો કચરો દૂર કરી ઐતર સાફ રાખવું. શેઢા-પાળા ચોખ્મા રાખવા તથા લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરિયા ૭૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

રોગોમાં ડાયબેક, છારો, પાન ઉપર ટપકાં પડવાં વગેરે જોવા મળે છે. જના નિયંત્રણ માટે દ્રાઇકોડર્મા ૨.૫-૩ કિ.ગ્રા. જમીનમાં આપવું. તેમજ વાર્ટિસિલિયમ લેકાની ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.

### ફૂલો ઉતારવા / ફૂલોની વિષી

સામાન્ય રીતે દેશી ગુલાબના ફૂલોની વીણી હંમેશા વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલાં અથવા સાંજના સમયે સાધારણ ખીલેલા અથવા તરત જ ખીલવાની તેચારીવાળા ફૂલો ઉતારવા જોઈએ અને ફૂલોને ઉતાર્યો બાદ તરત જ વાંસના ટોપલામાં કે ભીના કંતાનમાં કે કપડામાં બાંધી બજારમાં વેચાણ માટે મોકલવા જોઈએ.

### ફૂલોનું ઉત્પાદન

દેશી ગુલાબના ર થી ૩ વર્ષના છોડનું ફૂલોનું અંદાજીત ઉત્પાદન ૮ થી ૧૦ ટન પ્રતિ ફેક્ટર મળે છે.

## ૨. સેવંતી (ગુલદાઉડી)

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કૃ. થ્ય., જુનાગઢ)

કૂલોની વ્યાપારિક ખેતી કરવા ઈચ્છતાં ખેડૂતો માટે સેવંતી અગત્યનું સ્થાન ધરાવે છે. આર્થિક ધોરણે ગુલાબ પણી સેવંતી બિજા કમે આવે છે. સેવંતીને કૂલોની રાણી કહેવામાં આવે છે. તે વિવિધ પ્રકારના રંગ તથા આકાર ધરાવે છે. સેવંતીની મુખ્ય બે પ્રજાતિઓમાં કિસેન્થીમમ મોરીઝોલીયમ (કાયમી પ્રકારની) અને કિસેન્થીમમ ઈન્ડિકમ (સીઝનલ પ્રકારની) છે. સેવંતીના કૂલો બટન જેટલા કદથી માંડીને મધ્યમ કદના કોલીફ્લાવરના એડા જેટલા જોવા મળે છે. તેના કૂલ પૂજામાં, હાર, ગજરા તથા વેણી બનાવવા માટે તેમજ કટફ્લાવર તરીકે વપરાય છે. ભારતમાં સેવંતીની ખેતી મુખ્યત્વે કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, બિહાર અને રાજ્યસ્થાન વગેરે રાજ્યોમાં કરવામાં આવે છે. ગુજરાતમાં પણ વલસાડ, વડોદરા, આણંદ તથા ખેડા જિલ્લામાં સેવંતીની ખેતી વેપારી ધોરણે થાય છે.

સેવંતીની જાતો

(ક) મોટા કૂલવાળી જાતો :

- સિંગલ : કૂલની પાંદડીઓ એક હારમાં ૪ થી ૫ ની સંખ્યામાં જોવા મળે છે.
- એનિમોન : કૂલની પાંદડીઓ વધુ સંખ્યામાં અને મોટા કદની હોય છે.
- પોમપોન : કૂલ ગુચ્છામાં અને ગોળાકાર થાય છે. કૂલની પાંદડીઓ સુંવાળી, મજબૂત અને અંદરની બાજુ વળેલી હોય છે.
- ઇનકર્વર્ડ : કૂલની દરેક પાંદડી એકસરખી, આગળથી લીસી, અણીદાર અને અંદર વળેલી હોય છે.
- રીફ્લેક્સ : પાંદડીઓ છૂટી અને બહારની બાજુ કાટખૂણે વળેલી જોવા મળે છે.
- સ્પૂન : પાંદડીઓ છૂટી અને બહારની બાજુ કાટખૂણે વળેલી જોવા મળે છે.
- સ્પાઈડર : પાંદડીઓ લાંબી, નળી જેવી અને છેડા પર હુક જેવી રચના ધરાવે છે.
- બોલ : એડા આકારના કૂલની રચના હોય છે.
- જાપાનીઝ : ઇરેગ્યુલેટર : ઇન્ટરમીડિયેટ : કિવલ.

(ખ) નાના કૂલો ધરાવતી જાતો :

- એનીમોન : કૂલો કદમાં નાનાં જોવા મળે છે.
- કોરીયન : બે પાંદડી વચ્ચે જગ્યા જોવા મળે છે.
- કિવલ : પાંદડીઓ ભૂંગળી જેવા અને પીંછા આકારની હોય છે.
- બટન : કૂલો ખૂબ જ નાનાં ર થી ૩ સે.મી. કદના હોય છે.

(ગ) રંગ મુજબની જાતો :

- સફેદ : બ્યુટી સ્નોબોલ, ઇનોસન્સ, ગ્રીનગોડસ, પ્રીમીયર, અજુના વ્હાઇટ, વીલીયમ ટર્નર
- પીળી : ચંકડમાં, સુપર જાયન્ટ, ઇવનિંગ સ્ટાર, મેલોડીયન
- જાંબલી/ગુલાબી : અજુના પરપલ, પીટરમે, કલાઉડ, કલાસિક બ્યુટી
- અખરોટીયો લાલ રંગ : વિલ્સન, બ્રેવો, ડિસ્ટીક્શન

#### (ધ) દચ બજર માટેની રેગ પ્રમાણેની જતો :

- સ્ક્રેન : વ્હાઇટ રીએગન, કાસાકિમ પોલારીઝ
- પીળી : સનસાઈન, યલો સ્પાઈડર
- લાલ : ડાર્ક ફ્લેમેન્સ
- ગુલાબી : રીએગન, મની મેકર

#### (ય) કટફલાવરની જતો :

- સ્ક્રેન : બિરબલ સહની, હિમાની, જ્યોત્સના, હોરિઝન,
- પીળી : બસંતી, કુંદન, ફીડમ, સુજાતા
- લાલ : બ્લેઝ, જથા

#### (ષ) ફૂડામાં માટેની આકર્ષક જતો

- પીળી : ટોપાઝ, લીલીપુટ, અર્ચના, અપરાજીતા, શરદ શુંગાર
- સ્ક્રેન : મરકયુર, હની કોમ્બ, શરદમાલા, શરદશોભા, પરફેક્ટા

#### હવામાન

સેવંતીના છોડની વૃદ્ધિ માટે પૂરતાં પ્રમાણમાં પ્રકાશ અને મધ્યમ ઉષ્ણતામાન જરૂરી છે. લાંબો દિવસ અને ટુંકી રાત્રી વાનસ્પતિક વૃદ્ધિ માટે ઉપયોગી છે, જયારે ફૂલના વિકાસ માટે ટુંકા દિવસની આવશ્યકતા છે. રાત્રિનું ઉષ્ણતામાન ૧૦ થી ૧૨° સે. આદર્શ ગણાય છે. ગુજરાતની આબોહવામાં શિયાળો લાંબો હોય ત્યાં આ ફૂલનો પાક સારી રીતે લઈ શકાય તેમ છે.

#### જમીન

સેવંતીના પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળકૂપ સારાં નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. જમીનનો પી.એ.ચ. ૬.૦ થી ૭.૦ માફક આવે છે વધુ ઉત્પાદન મેળવવા સેન્ટ્રિય ખાતર ઉપરાં જરૂરી છે.

#### વર્ધન

(૧) બીજ : સીઝનલ સેવંતીનું વર્ધન મુખ્યત્વે બીજથી થાય છે. સંપૂર્ણ પરિપક્વ તંદુરસ્ત બીજ માર્ચ-એપ્રિલ માસમાં એકત્ર કરી, લેજરહિત જગ્યામાં સંગ્રહ કરી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં વાવણી માટે ઉપયોગ કરવો.

(૨) પીલા : વર્ષાયુ સેવંતીના મૂળ નજીક ચોમાસામાં પીલા ફૂટે છે જે મૂળ સહિત છૂટાં પાડી રોપણી પહેલાં ૧૫ દિવસ આરામ આપી રોપણી કરવી.

(૩) કટકા : વર્ષાયુ સેવંતીના છોડની ડાળના ટુકડા બનાવી રોપણી માટે ઉપયોગ કરવો.

#### રોપણી

બીજથી તૈયાર કરેલ ધર્ઢવાડીયું ૨૧ થી ૩૦ દિવસ દરમ્યાન તૈયાર થઈ જાય છે. જેને તૈયાર કરેલ જમીનમાં જે તે જતના ફેલાવા અનુસાર ૩૦ સે.મી. × ૩૦ સે.મી., ૪૫ સે.મી. × ૪૫ સે.મી., ૪૫ સે.મી. × ૬૦ સે.મી.ના અંતરે રોપણી કરવી. રોપણી ઓક્ટોબર-નવેમ્બરમાં કરી શકાય છે. વર્ષાયુ છોડની રોપણી જુલાઈ-ઓગષ્ટમાં કરવામાં આવે છે. પાણા ૩૦ સે.મી. પહોળા રાખી પાળાની બંને ધારે છોડ રોપવા પાણી નીકમાં આપવું.

#### ખાતર

જે જમીનમાં સેવંતીનું વાવેતર કરવું હોય તે જમીનમાં જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૨૦ થી ૨૫ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે ક્ર્યુસ્ટ ખાતર લેળવી જમીનને ખેડી ભરભરી બનાવવી. તથા લીલા પડવાશ તરીકે શાણનું

---

વાવેતર સેવંતીના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એગ્ઝિપ્રીલમ અને ફોસ્ફોબેક્ટર બેક્ટેરીયા ૨.૫ કિ.ગ્રા./ ફેક્ટર નાખવા. ૫ ટન/ ફેક્ટર વર્મિક્રોપોસ્ટ સેવંતીના વાવેતર સમયે આપવું.

### પિયત

ચોમાસામાં વરસાદ ન હોય તો વર્ષાયુ સેવંતીને જરૂર મુજબ પિયત આપવું. શિયાળામાં સેવંતીને ૭ થી ૧૦ દિવસે તથા ઉનાળામાં ૩ થી ૫ દિવસના અંતરે પિયત આપવું. કૂલકળી અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થા ગણી શકાય.

### ખૂંટણ

છોડને વધુ ડાળીઓ તથા સારી ગુણવત્તાવાળા ફૂલો મેળવવા રોપણી બાદ દોઢ માસે અગ્રભાગ ૩ થી ૫ સે.મી. કાપવો જેથી વધુ ફૂટ મળશે અને વધારે ફૂલ આવશે.

### છોડને ટેકો આપવો

વર્ષાયુ છોડની વધુ ઉંચાઈવાળી જાતોના છોડને વાંસના કટકાથી ટેકા આપવાથી સારી ગુણવત્તાવાળા ફૂલ મેળવી શકાય. સીઝનલ છોડને ટેકાની જરૂરિયાત રહેતી નથી.

### ઇતર કાર્યો

છોડને નીંદણમુકત રાખવો શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવી. સીઝનલ છોડને સાધારણ પાળી ચઢાવવી.

### ફૂલ ઉતારવા

ફૂલને સંપૂર્ણ ખીલ્યા બાદ સામાન્ય રીતે વહેલી સવારે અથવા સાંજના સમયે ઉતારવા જોઈએ. કટફલાવરની કાપણી ફૂલ ખીલતાં પહેલાં કરી વ્યવસ્થિત પેક કરવા. કટફલાવરને કાણાંવાળા બોક્ષમાં જયારે છૂટાં ફૂલ ટેપલીમાં મુકી તેના ઉપર ભીનું કપડું મુકી વેચાણ માટે મોકલવા.

### ઉત્પાદન

સીઝનલ સેવંતી ૨૨ થી ૨૫ ટન પ્રતિ ફેક્ટરે ફૂલ આપે છે, જયારે અન્ય જાતો ઓછું ઉત્પાદન આપે છે.

### આવક-ખર્ચ

ભાવ પ્રતિ કિ.ગ્રા.ના રૂપિયા ૧૦ ગણાતાં અંદાજીત એક લાખથી સવા લાખ જેટલી આવક ફેક્ટરે મળી રહે છે. ફેક્ટરે ઉત્પાદન ખર્ચ રૂપિયા ૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ હજાર થાય છે.

### સેવંતીના પુષ્પોનું આયુષ્ય લંબાવવા માટે જરૂરી સૂચનો :

- (૧) રોગ-જીવાતમુકત છોડ પરથી ફૂલો પસંદ કરી અલગ રાખવા.
- (૨) તાજા જ ખીલેતાં પૂષ્પો ઉતારવા.
- (૩) ફૂલો વહેલી સવારે કે સૂર્યાસ્ત બાદ ઉતારવા.
- (૪) છૂટાં ફૂલો દાંડી સાથે ચૂંટવા.
- (૫) ફૂલો ઉતાર્યા બાદ તેના પર પાણી છાંટવું.
- (૬) કટફલાવરસના ફૂલો ધારદાર ચખ્યુ કે સીકેટરની મદદથી લાંબી દાંડી સાથે કાપીને ઉતારવા.

## ૩. ગેલાડિયા

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કુ. થ્ય., જૂનાગઢ)

ગેલાડિયા દરેક પ્રકારના વાતાવરણ અને જમીનને અનુકૂળ સરળતાથી ઉગાડી શકાય તેવા સુંદર, સર્વકાલીન અને સુલભ વર્ષાયુ ફૂલછોડ છે. ગેલાડિયાને અંગ્રેજુમાં બ્લેન્કેટ ફ્લાવર અને ગુજરાતીમાં ગાદલીયા તરીકે ઓળખવામાં આવે છે. ગેલાડિયા એ કંપોઝિટી ફૂળનો મધ્યમ ઉંચાઈનો, બારેમાસ સહેલાઈથી વાવી શકાય તેવો છોડ છે. આ છોડના ફૂલ ગલગોટા જેવા આકારના લાંબી દાંડીવાળા સિંગલ કે ડબલ પ્રકારના સેવંતી જેવા મોટાં અને આકર્ષક રંગવાળા હોય છે. ફૂલ પીળા, ભૂખરા, તામ્ર લાલ, કેસરી, મેલા, બદામી કે લાલ બહુરંગી રંગના હોય છે. કેટલાંક લાલ તામ્ર રંગના ફૂલોને સફેદ કે લાલ કિનારી પણ જોવા મળે છે અથવા ઘણી વખત કેસરી લાલ ફૂલોને પીળી કિનારી પણ જોવા મળે છે.

### ઉપયોગ

ગેલાડિયાના ફૂલછોડ બગીચામાં કયારાઓમાં અને બોર્ડર તરીકે મોટા પાચા ઉપર વાવવામાં આવે છે. ગેલાડિયાના છોડ જયારે પૂરેપૂરા ફૂલોથી ખીલે છે ત્યારે બગીચામાં રંગબેરંગી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય ઉપસી આવે છે. ગેલાડિયાના ફૂલોનો છૂટાં ફૂલ તરીકે, સુશોભન માટે હાર, વેણી બનાવવામાં તથા પૂજાપાઠમાં તેમજ ફૂલોની શેરોનો ઉપયોગ મંડપ અને સેજ શણુગારવામાં ખૂબજ બહોળા પ્રમાણમાં થાય છે. ગેલાડિયાનો છોડ વિકસિત થતાં જમીન પર પથરાતો હોઈ જે જગ્યાએ પાણીથી ધોવાણ થવાની શક્યતા હોય ત્યાં ગેલાડિયા પલચેલા જાતની રોપણી કરવાથી જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે.

### વિવિધ જાતો

(૧) ગેલાડિયા પલચેલા વેરાયટી પિકટા : આ પ્રકારની જાતોના ફૂલો કદમાં મોટાં પરંતુ સિંગલ પ્રકારના હોય છે. આ પ્રકારના ઈન્ડિયન ચીક અને પિકટા મિક્સડ એમ બે જાતો છે.

(૨) ગેલાડિયા પલચેલા વેરાયટી લોરેન્ઝીયાના : આ પ્રકારની જાતોના ફૂલ કોમળ, સુંવાળા અને ડબલ પ્રકારના છે. પાંખડી ગોળ વળેલી, નલિકા આકારની છેડે વિભક્ત અને એકજ ફૂલમાં કેટલાંક આકર્ષક રંગોના મિશ્રણવાળી હોય છે. આ પ્રકાર સનસાઈન સ્ટ્રેઇન ગેઈટ ડબલ તથા ડબલ ટેટ્રાફિએસ્ટા જાતો વિશેષ પ્રચલિત છે. ડબલ ટેટ્રા ફિએસ્ટા જાતના ફૂલ મોટાં, ડબલ પાંખડીવાળાં, ચમકદાર, ધૂમ્ર લાલ રંગના અને છેડા ઉપર ચળકતા પીળા રંગની નલિકાઓવાળા જોવા મળે છે.

(૩) ગેલાડિયા ગ્રાન્ડીફ્લોરા : આ જાતના છોડ બહુવર્ષાયુ, કાયમી પ્રકારના અને મજબૂત પ્રકૃતિવાળા તેમજ વધુ વિકાસ ધરાવતાં હોય છે, જેનું વાવેતર કર્યા બાદ અમુક વર્ષ સુધી ફૂલો આપે છે. પરંતુ ફૂલોની ગુણવત્તા અને ઉત્પાદન ઉપરની બે પ્રકારની જાતોની સરખામણીએ ઉત્તરતી કક્ષાનાં જોવા મળે છે જેમાં નીચે મુજબની જાતો પ્રચલિત છે.

(૧) બ્રિમેન : તામ્ર લાલ પીળાં (૨) બર્ગન્ડી : તામ્ર લાલ (૩) ક્રોબોલ ગોબ્લિન : પીળો (૪) રિગેલીસ : લાલ (૫) મોનાર્ક ટેઇન : મિક્સ રંગ (૬) સેન્ટ્રિનિયા : લાલ રંગ

### આબોહન્વા

ગેલાડિયા દરેક ઋતુમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. ગેલાડિયાના છોડ સખત પ્રકારના છે, જે વધુ ગરમી અને પાણીના અછતમાં પણ લાંબો સમય રહી શકે છે. સામાન્ય રીતે ગરમ લેજવાળું વાતાવરણ વધારે અનુકૂળ આવે છે, તે ઉનાળા અને ચોમાસા દરમ્યાન સરળતાથી ઉગાડી શકાય છે.

### જરીન

દરેક પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે પરંતુ ભારે કાળી, ચીકણી અને ઓછી નિતાર શક્તિવાળી જમીન કે

જયાં પાણીનો ભરાવો થતો હોય તેવી જમીન અનુકૂળ આવતી નથી. સારી નિતાર શક્તિવાળી જમીન પસંદ કરવી જોઈએ.

## ખાતર

જે જમીનમાં ગેલાર્ડિયાનું વાવેતર કરવું હોય તે જમીનમાં હેક્ટર દીઠ ૧૫ થી ૨૦ ટન કોહવાચેલું છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર લેળવી જમીનને એડી ભરભરી બનાવવી તથા લીલા પડવાશ તરીકે શાણનું વાવેતર ગેલાર્ડિયાના વાવેતર પહેલાં ૬૦ દિવસે કરવું. એઝોસ્પેરીલમ અને ફોસ્ફોબેક્ટર બેક્ટેરીયા ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર નાખવા. ૫ ટન/ હેક્ટર વર્માકમ્પોસ્ટ ગેલાર્ડિયાના વાવેતર સમયે તથા ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને આપવું.

## પ્રસર્જન

વર્ષાયું ગેલાર્ડિયાની જાતોનું પ્રસર્જન બીજથી કરવામાં આવે છે, જ્યારે કાયમી જાતોનું પ્રસર્જન બીજ તથા કટકાથી પણ કરી શકાય છે.

## રોપણી

આ પાકની રોપણી કરવાની હોય ત્યારે ખેતરને વ્યવસ્થિત ઘેડ કરી જમીન તૈયાર કરી કયારાઓ બનાવી ચાર થી છ અઠવાડિયાની ઉંમરનું ગેલાર્ડિયાનું ધરું ૩૦ સે.મી. × ૩૦ સે.મી. અથવા ૪૫ સે.મી. × ૩૦ સે.મી.ના અંતરે ઉનાળું પાક માટે ફેબ્રૂઆરી-માર્ચમાં, ચોમાસુ પાક માટે જૂન-જુલાઈમાં અને શિયાળું પાક માટે સાટેમ્બર-ઓક્ટોબર માસમાં રોપીને ફૂલ મેળવી શકાય છે. ખાસ કરીને ચોમાસામાં જયાં ભારે વરસાદ હોય ત્યાં આ પાક લેવામાં આવતો નથી કારણકે ભારે વરસાદના કારણે છોડ જમીન પર ફળી જાય છે અને ફૂલોની ગુણવત્તા ખરાબ થઈ જાય છે.

## અન્ય માવજત

છોડ રોપ્યા બાદ હળવું પાણી આપવું, અન્ય પિયત ઝતું પ્રમાણે ઉનાળામાં પ થી ૭ દિવસે અને શિયાળામાં ૮ થી ૧૦ દિવસના અંતરે જમીનના પ્રકારના પ્રમાણે આપવામાં આવે છે. જરૂર જણાય ત્યારે કયારાઓમાંથી નીદણ દૂર કરવું. છોડના સારા વિકાસ માટે ત્રણ થી ચાર વખત હળવો ગોડ કરવો જોઈએ. છોડના વિકાસ દરમ્યાન મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો વનસ્પતિજન્ય/ સુક્ષ્મ જીવાણું આધરિત દવાનો છંટકાવ કરવો.

## રોગ અને જીવાત

આ પાકને ખાસ કોઈ રોગ જીવાત લાગતા નથી. આમ છતાં ઘણીવાર મોલોમશીનો ઉપદ્રવ જણાય ત્યારે લીમડાના અક્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. બીવેરીયા ૭૫ ગ્રામ/ ૧૦ લીટરના ક્રાવણનો છંટકાવ કરવો. તદ્વારાંત વનસ્પતિજન્ય કિટનાશી ઔષધોમાં સીતાકણ, આંકડો, ધતુરો અને અરડુસી સહિત ઘણી જાતની વનસ્પતિ જીવાતના નિયંત્રણ કરવાનો ગુણધર્મ ધરાવે છે.

## ફૂલ ઉતારવા

છોડની રોપણી બાદ ત્રણ થી સાડા ત્રણ માસ બાદ ફૂલ તૈયાર થાય છે. છૂટાં ફૂલ (લુઝ ફલાવર) તરીકે ઉતારવામાં આવે છે. ફૂલોને દૂરના બજારમાં મોકલવાના હોય તો આગલાં દિવસે સાંજે અને નજીકના બજારમાં મોકલવાના હોય તો વહેલી સવારે ઉતારવામાં આવે છે. ઉતારેલ ફૂલોને હળવું પાણી છાંટીને ટોપલામાં વ્યવસ્થિત રીતે ભરીને ઉપર ભીનું કપડું ઢાંકીને બજારમાં મોકલવા.

## ઉત્પાદન

સારી માવજત કરેલ ખેતરમાંથી હેક્ટર દીઠ ૧૬ થી ૧૮ ટન જેટલા ફૂલોનું ઉત્પાદન મળે છે. ગેલાર્ડિયાના ફૂલોનો જથ્થાબંધ ભાવ માંગ પ્રમાણે સામાન્ય રીતે ૧ કિ.ગ્રા.ના પ થી ૭ રૂપિયા જેટલો હોય છે. આમ હેક્ટરે ૮૦,૦૦૦ થી ૧,૧૦,૦૦૦ રૂપિયા સુધી આવક મેળવી શકાય છે જ્યારે હેક્ટર દીઠ આશરે ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. ચોમાસા કરતાં શિયાળું ઝતુમાં ઉત્પાદન તેમજ આવક વધુ મળે છે.

## ૪. મોગરા અને પારસ

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કૃ. થુ., જૂનાગઢ)

મોગરા અને પારસને અંગેજીમાં જાસ્મીન તરીકે ઓળખવામાં આવે છે જો કે જાસ્મીન કુટુંબમાં જુઈ, ચમેલી વગેરે ફૂલોનો પણ સમાવેશ થાય છે. મોગરાનું ફૂલ સફેદ રંગનું અને સુગંધદાર છે. પરંતુ સુશોભનની દ્રષ્ટિએ મોગરાનું સ્થાન આગાવું છે. મોગરા અને પારસને ઘરાંગણે કથારામાં તેમજ ફૂલામાં પણ ઉછેરી શકાય છે. બગીચામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે. મોગરાના ફૂલ ખાસ કરીને ઉનાળામાં અને પારસના ફૂલ શિયાળામાં આવતાં હોય છે. પારસના ફૂલ મોગરા જેવા જ સફેદ રંગના પરંતુ તેમાં સુગંધ મોગરા કરતાં ઓછી હોય છે. મોગરા અને પારસના ફૂલ હાર બનાવવા માટે, વેણી તથા પૂજા પાઠમાં છૂટાં ફૂલ તરીકે ઉપયોગમાં લેવાય છે. મોગરામાંથી ખૂબજ કિંમતી એવું સુગંધી તેલ (અત્તર) કાઢવામાં આવે છે. જેનો ઉપયોગ પરફ્યુમ તેમજ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે. મોગરાની જેતી દક્ષિણ ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકમાં સારાં એવા પ્રમાણમાં કરવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને સુગંધી તેલ (અત્તર) કાઢવામાં થાય છે. ઉત્તર ભારતમાં લખનૌમાં મોગરાની જેતી કરવામાં આવે છે. તદુપરાંત પૂના તથા નાસિક જેવા વિસ્તારમાં પણ મોગરા વ્યાપારિક રીતે ઉગાડવામાં આવે છે. આપણાં રાજ્યમાં હાલ વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત અને કચ્છ જિલ્લાઓમાં મોગરાની જેતી થાય છે, જેનો અંદાજીત વિસ્તાર ૫૦૦ હેક્ટાર અને ફૂલોનું ઉત્પાદન ૩૨૦૦ ટન છે.

### આબોહવા

મોગરાને ખાસ કરીને ગરમ અને લેજવાળું, જ્યારે પારસને ઠંડુ અને સુર્કું હવામાન વધુ અનુકૂળ આવે છે. આમ છતાં પણ આ છોડ વિવિધ પ્રકારના હવામાનમાં સારી રીતે ઉછેરી શકાય છે પરંતુ વ્યાપારિક રીતે ઉત્પાદન મેળવવા માટે સમધાત હવામાન ખાસ જરૂરી છે.

### જમીન

મોગરાના પાકને ખાસ કરીને પૂરતો પ્રકાશ મળી શકે તેવી સારાં નિતારવાળી ખૂબજ ભારે નહીં તેવી જમીન વધુ માફક આવે છે.

### રોપણી

જમીનમાં કટકા કલમ, ગુટી કલમ, દાબ કલમ/પીલાથી તૈયાર કરેલ કલમો જૂન-જુલાઈ અથવા સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં રોપવી જોઈએ. મોગરાની રોપણી ૧ મીટર  $\times$  ૧ મીટરના અંતરે કરવી જોઈએ. જ્યારે પારસ મોગરાની રોપણી ૧.૫ મીટર  $\times$  ૧.૫ મીટરના અંતરે કરવી જોઈએ. જે માટે ખાડા ૩૦ સે.મી.  $\times$  ૩૦ સે.મી.  $\times$  ૩૦ સે.મી. માપના કરવા જરૂરી છે. દરેક ખાડા દીઠ ૨ થી ૩ કિ.ગ્રા. સારું કોહવાયેલ છાણીયું ખાતર અથવા વર્મિકમ્પોસ્ટ ૧ કિ.ગ્રા. નાખી વાવેતર કરવું.

### પ્રસર્જન

મોગરાનું પ્રસર્જન કટકા કલમ, ગુટી કલમ અથવા દાબ કલમથી થાય છે, જ્યારે પારસનું પ્રસર્જન મૂળમાંથી ફૂટેલ પીલાઓ દ્વારા અથવા દાબ કલમથી થાય છે.

### જાતો

મોગરા અને પારસમાં ખાસ વિશિષ્ટ જાતો નથી, પરંતુ મોગરામાં ફૂલની પાંખડીની સંખ્યા, પાંખડીનો આકાર અને ફૂલના કદના આધારે મોગરાને મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચવામાં આવે છે.

(૧) દેશી બેલા અથવા હજારા : એક વડા સાદા ફૂલવાળી જાત.

(૨) મોતિયા : બેવડાં ફૂલ અને ઘોળ આકારની પાંખડીવાળી જાત.

(૩) બેલા : બેવડાં ફૂલ અને લાંબી પાંખડીવાળી જાત.

(૪) બટ મોગરા : લખોટા જેવા ૨.૫ સે.મી. જેટલા વ્યાસવાળા ફૂલ હોય છે, જેમાં પાંખડીની સંખ્યા વધારે હોય છે.

#### ખાતર

મોગરા અને પારસ પાકને દર વર્ષે છોડ દીઠ ૧૦૦ ગ્રામ છાણીયું ખાતર અને ૧૦૦ ગ્રામ મગફળીનો ઘોળ આપવો. ઉપરોક્ત ખાતર તથા ઘોળ છોડની છાંટણી કર્યા પછી માટીમાં બરાબર લેળવીને આપવું. લીલા પડવાશ તરીકે શણ અથવા છક્કડનું વાવેતર કરવું. મલ્યીંગ તરીકે સેન્ઝિય પદાર્થોનો ઉપયોગ કરવો. જેથી જમીનની ફળક્રૂપતા વધશે અને જમીનનું ધોવાણ અટકશે.

#### પિયત

મોગરાને જમીનની પ્રત તેમજ આબોહવા પ્રમાણે ઉનાળામાં પ થી ૬ દિવસે પિયત આપવું અને શિયાળા દરમ્યાન છોડને પિયત બંધ કરી સુષુપ્ત અવસ્થામાં રાખી આરામ આપવો. જ્યારે પારસમાં શિયાળામાં ફૂલો આવતાં હોઈ શિયાળામાં ૮ થી ૧૦ દિવસે પિયત આપવું જરૂરી છે.

#### છાંટણી

- મોગરા:** મોગરાને મુખ્યત્વે ઉનાળામાં ફૂલ વધુ છે, જ્યારે શિયાળા દરમ્યાન સુષુપ્ત અવસ્થામાં રહે છે. તેથી ખાસ કરીને ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાથી જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં છાંટણી કરવી હિતાવહ છે.
- પારસ:** પારસની છાંટણી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં કરવી. જૂના છોડને ૩ થી ૫ વર્ષમાં એકવાર નબળી, વેલા જેવી ડાળીઓની લંબાઈનો ૨/૩ જેટલો ભાગ કાપી નાખી ભારે છાંટણી કરવી, જેથી છોડના થડમાંથી નવા જૂસસાવાળી ડાળીઓ નીકળે અને ફૂલનું વધુ ઉત્પાદન મળે. છોડને છાંટણીના એક માસ અગાઉ પાણી બંધ કરવું જરૂરી છે.

#### રોગ અને જીવાત

સામાન્ય રીતે મોગરા અને પારસમાં કોઈ ખાસ પ્રકારના રોગ કે જીવાત જોવા મળતાં નથી. પરંતુ મોલો-મશી તેમજ બિંગડાવાળી જીવાત જેવા કીટકો કચારેક આબોહવાની વિષમ પરિસ્થિતિમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટે ખેતરમાં રહેલ વધારાનો કચરો દૂર કરી ખેતર સાફ રાખવું. શેઢા-પાળા યોખા રાખવા. તથા લીમડાના અર્કમાંથી બનાવેલ દવા ૫% નો છંટકાવ કરવો. મોલો-મશીનો ઉપક્રમ જણાય ત્યારે બીવેરીયા ૭૫ ગ્રામ/૧૦ લીટરના દ્રાવણનો છંટકાવ કરવો.

#### ફૂલ ઉતારવા

મોગરા અને પારસની પૂર્ણ વિકાસ પામેલી સર્કેદ રેગની કળીઓ સંજના સમયે અથવા વહેલી સવારે ચૂંટવી, ત્યારબાદ તેને વાંસની ટોપલીમાં ભીના કંતાન/કપડામાં નાંખી પેકિંગ કરી વહેલી સવારે બજારમાં મોકલવા. મોગરાનો પાક ઉનાળામાં આવે છે, જ્યારે પારસનો પાક શિયાળામાં આવે છે. જો આ બંને પાકોનું વાવેતર એક સાથે થોડાં થોડાં વિસ્તારમાં કરવામાં આવે તો ખેડૂતોને આખા વર્ષ સુધી ફૂલોનું ઉત્પાદન મળી રહે તથા બજારમાં વેચાણ માટે મોકલીને સારી એવી આવક મેળવી શકાય છે.

#### ઉત્પાદન

મોગરા અને પારસમાં વ્યાપારિક ધોરણે ફૂલ ઉત્પાદન ત્રીજા વર્ષથી મળવાનું શરૂ થાય છે જે પાંચમાં વર્ષે મહત્તમ હોય છે. મોગરામાં ૧૦ થી ૧૫ વર્ષ સુધી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે. હેકટરે લગભગ ૫૦૦૦ થી ૬૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મળે છે, જ્યારે પારસ મોગરાના ફૂલોનું અંદાજુત ઉત્પાદન ૩૦૦૦ થી ૪૦૦૦ કિ.ગ્રા. જેટલું મળે છે.

## પ. સ્પાઈડર લીલી

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કુ. થ્ય., જૂનાગઢ)

સ્પાઈડર લીલીના ફૂલો તેના સફેદ રંગની અને માદક સુગંધને લીધે હાર, વેણી, ગજરાં અને લળ મંડપ તેમજ જહેર સમારંભોના સ્ટેજના શણગારમાં ખુબજ અગત્યનું સ્થાન ધરાવે છે. લીલી તરીક ઓળખાતાં ફૂલ વર્ગમાં અનેકવિધ પ્રકારો જોવા મળે છે. તેમાં મોટા ભાગના કંદમૂળ પ્રકારના લીલીએસી ફૂળ અથવા તેને સંલગ્ન ફૂળ જેવા કે એમરેલીડેસી, ઈરીડેસી ફૂળ ધરાવે છે. આ વર્ગના છોડમાં પણો કંદમાંથી વિકાસ પામી સમાંતર નસોવાળા, લાંબા અને સાંકડા પાનના જથ્થા વચ્ચેથી નીકળતાં દંડ પર ફૂલો આવે છે. ફૂલો વિવિધ આકારના અને સફેદ તેમજ લાલ, ગુલાબી, પીળાં, જંબલી અને મિશ્ર રંગોવાળા હોય છે. લીલીમાં અન્ય વર્ગોમાં કુટબોલ લીલી, ટાયગર લીલી, ટોર્ચ લીલી, ડે લીલી, ગ્લોરી લીલી, આફિકન લીલી, વોટર લીલી, જેફીરન્થસ લીલી જેવી અનેક જાતિઓ અને પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આમાંની મોટા ભાગની લીલીની જાતોના ફૂલો કટકલાવર તરીકે અથવા બગીચાની શોભાના છોડ તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્પાઈડર લીલીના ફૂલોનો ઉપયોગ હાર બનાવવા તેમજ શણગારમાં વિશેષ થાય છે. ઉનાળામાં બજારમાં બીજા ફૂલો વધુ ન મળતાં હોવાથી તેમજ લઘુનગાળાને કારણે લીલીના ફૂલની માંગ વધુ રહે છે. લીલીના ફૂલની મહેક એક-બે દિવસ ટકતી હોવાથી શણગારમાં વિશેષ ફાયદાકરક રહે છે.

સ્પાઈડર લીલીના ફૂલની પાંદડીઓ કરોળીયાના પગોની જેમ ફેલાયેલ છે તેથી તેને સ્પાઈડર લીલી નામ પાડવામાં આવેલું છે, તેના લીલા રંગના પાન જમીનમાં રોપેલ કંદમાંથી અંગ્રેજી “વી” આકારે ફુટે છે. પુષ્ટ વયના પાન આશરે ૬૦ થી ૭૦ સે.મી. સુધીની લંબાઈ ધરાવે છે અને ઘેરા લીલા રંગના આશરે ૩ સે.મી. પહોળાઈના તલવાર જેવા આકારના હોય છે. પાનના ઝૂમખાના મધ્ય ભાગથી એક દાંડી નીકળે છે એ દાંડીના ટોચના ભાગો સૌ પ્રથમ બંધ દડો નીકળે છે એ દડો ખુલ્લો થતાં તેમાંથી આશરે ૬ થી ૧૨ ફૂલોની દાંડી અને સફેદ અગ્ર ભાગવાળી કળી નીકળે છે. જે ખીલતા પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે.

### સંવર્ધન

આ પાકનું સંવર્ધન ગાંઠોથી થાય છે.

### જાતો

સ્પાઈડર લીલીમાં ખેડૂતોના એતરે બે જાતો જોવા મળે છે. એક સાંકડા અને એક ઘેરા લીલા રંગના પાનવાળી જાત જે ફક્ત ચોમાસામાં ફૂલ આપે છે. બીજી જાત પહોળા અને આછા લીલા રંગની છે જે બારેમાસ ફૂલો આપે છે. ખેડૂતોએ બારેમાસ ફૂલો આપતી જાતનું જ વાવેતર કરવું જોઈએ.

### આબોહવા

લીલીને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધારે માફક આવે છે. છતાંથી લીલી એ હંડાથી ગરમ કોઈપણ પ્રકારના હવામાનમાં થઈ શકે તેવો પાક છે. ઉષ્ણકટિબંધના સૂકાં, સપાટ વિસ્તારથી ઢોળાવવાળા વિસ્તારોમાં તેમજ સૂર્યપ્રકાશમાં અથવા થોડા છાંચાવવાળા ભાગો પણ તેનો ઉછેર શક્ય બને છે.

### જમીન અને જમીનની તેચારી

લીલીની એતી માટે ફળદૂપ, ગોરાડું તથા મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ભારે કાળી અને ક્ષારવાળી જમીનમાં પણ ઉછેરી શક્ય છે. લીલીમાં કંદથી વાવેતર કરતા પહેલાં જમીનને બરાબર ખેડીને ભરભરી બનાવવી ત્યારબાદ સમતળ કરી સરખા માપના લાંબા કચારાઓ બનાવવા જોઈએ.

## રોપણી

સ્પાઈડર લીલીનો પાક બહુવર્ષાયું છે. એકવાર રોપણ કર્યા બાદ વારંવાર રોપવાની જરૂર રહેતી નથી આશરે પ થી જ વર્ષ સુધી સફળતાપૂર્વક પાક લઈ શકાય છે. સ્પાઈડર લીલીનું વર્ધન તેના કંદની રોપણી કરીને થાય છે. જુના પાકના છોડને જમીનમાંથી ખોડતાં એક છોડમાંથી પ થી જ જેટલા કંદ મળે છે, જેને એક બીજાથી અલગ કરી પાનનો ભાગ સાફ કરી રોપણી માટે વપરાશમાં લેવા. કંદની રોપણી બે હાર વચ્ચે ૪૫ થી ૬૦ સે.મી. અંતર અને એક હારમાં બે છોડ વચ્ચે ૨૦ સે.મી.નું અંતર રાખી કરવી જોઈએ. સામાન્ય રીતે ખેડૂતો બે હાર વચ્ચે ૬૦ સે.મી અંતર રાખી રોપણી કરે છે. જેથી આંતરખેડ અને ફૂલ ઉતારવાની કામગીરીની અનુકૂળતા રહે, પરંતુ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઓછી થતા ઉત્પાદન પર અસર થાય છે. આશરે ૩ વર્ષ બાદ એક કંદમાંથી નવા પ થી ૬ કંદનું સર્જન થતાં સમય જતાં ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. અમુક ખેડૂતો ડબલ હારની પદ્ધતિથી પણ વાવેતર કરે છે. જેમાં બે હાર વચ્ચે ૬૦ સે.મી.નું અંતર રાખે છે.

## ખાતર

આ પાક આખા વર્ષ દરમ્યાન વિકાસ પામતો અને એકવાર વાવેતર કર્યા બાદ લાંબો સમય સચવાતો હોઈ પોષકતત્વોની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. જમીન તૈયાર કરતી વખતે હેક્ટર દીઠ ૩૦ ટન સારું કોહવાયેલ છાણીયું ખાતર મે-જૂન માસમાં જમીનમાં લેળવં. લીલા પડવાશ તરીકે ગુવારનું વાવેતર કરી ફૂલ અવસ્થા પહેલા જમીનમાં લેળવી સડવા દેવું, આમ કરવાથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થતા પાકની વૃધ્ષિ સારી થાય છે. એઝોસ્પીરીલમ અને ફોસ્ફોબેક્ટર બેકટેરીયા ૪.૦ કિ.ગ્રા./હેક્ટર નાખવા. લીલીમાં વાવેતર સમયે ૧૦ ટન/હેક્ટર વર્મિકમ્પોસ્ટ આપવું.

## પિયત

કંદના વાવેતર બાદ હળવું પાણી આપવું ત્યારબાદ સ્કુરણ સુધી ખૂબજ મર્યાદિત જથ્થામાં જરૂર પૂરતું જ પિયત આપવું. સંપૂર્ણ કંદનું સ્કુરણ થયા બાદ સતત લેજ રહે તેમ પિયત પ્રમાણ વધારવું. આખા વર્ષ દરમ્યાન પાક લેવાનો હોઈ શકતું પ્રમાણે ૩ થી ૭ દિવસે પિયત આપતા રહેવું. શિયાળાની ઋતુમાં આ પાકને થોડો આરામ આપી શકાય, પરંતુ શિયાળામાં લઘુ સિઝનમાં માંગ વધવાને કારણે ફૂલોનો પૂરતો ભાવ મળતો હોવાથી ખેડૂત થોડું ઓછું ઉત્પાદન લઈ પોષણક્ષમ ભાવ મેળવતા હોય છે જેથી પિયત આપવું પડે છે.

## ઘેતીકાર્યો

છોડનો પૂરતો વિકાસ ન થાય ત્યાં સુધી નિંદામણ કરવાની જરૂર રહે છે. છોડના મૂળ જમીન બહાર દેખાય તો માટી ચઢાવવી. છોડ પરના સૂકાં, પાન, સૂકાં ફૂલ તેમજ નકામી ફૂલદાંડીઓને અવારનવાર કાપતાં રહેવું જરૂરી છે. શિયાળા દરમ્યાન છોડના ઉપરના બધા જ પાન કાપી જમીનમાં લેળવી દેવા જેથી જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો થાય છે.

## પાક સંરક્ષણ

સામાન્ય રીતે લીલીના પાકમાં ખાસ કોઈ રોગ-જીવાત જોવા મળતાં નથી, એટલે વધારે કાળજી રાખવી પડતી નથી. ઇતાં પણ આ પાકમાં પાન કોરી ખાનાર અને ફૂલને નુકશાન કરતી ઈયણો અને મોલો-મશી જેવી જીવાતો જોવા મળે છે. પાન કોરી ખાનાર અને ફૂલને નુકશાન કરતી ઈયણોના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ તથા મોલો-મશીના નિયંત્રણ માટે લીમડાના પાનનો અર્ક ૧૦% મુજબ છંટકાવ કરવો.

આ પાક કંદમૂળ પ્રકારનો હોઈ થોડા રોગોનો સામનો કરવો પડે છે. જેમાં કંદનો સડો અને ફ્યુજેરીયમ જેવા રોગોના નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા વિરીડી ૨.૫ કિ.ગ્રા./હેક્ટર અને સ્યુડોમોનાસ ફલુઓરેસન્સ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર આપવું.

## ફૂલોની વીણી

સ્પાઈડર લીલીના ફૂલોની કળીને બંધ પરંતુ પૂરેપૂરી પરિપક્વ અવસ્થાએ કાપણી કરવી જોઈએ. કળી ચુંટવાની કામગીરી વહેલી સવારે અથવા સાંજના ઠંડા પહોરે કરવી. ચુંટેલી કળીઓ પણ અથવા ૧૦૦ નંગના માપમાં ઝૂડીઓ બાંધવી.

---

આ ઝૂડીને ટોપલી, કંતાનની થેલીઓમાં કે પ્લાસ્ટિક બેગમાં પેક કરી બજારમાં રવાના કરવી. ટ્રાન્સપોર્ટમાં ફૂલને નુકસાનથી બચાવવા માટે ઝૂડીને પૂંઠાના ખોખા અથવા પ્લાસ્ટિક થેલીમાં મોકલવાથી બજારભાવ સારા મળે છે.

### ઉત્પાદન અને બજારભાવ

ઉનાળું તેમજ યોમાસુ ઋતુમાં શિયાળાની ઋતુ કરતાં વધુ ઉત્પાદન મળે છે, તેમ છતાં ઉત્પાદનનો આધાર જમીન, ખાતર, પાણી અને એતીકાયોની માવજત પર રહે છે. આખા વર્ષનું ઉત્પાદન લક્ષમાં લેતાં હેકટર દીઠ પથી ૬ લાખ ઝૂડીઓ જેટલું ઉત્પાદન મળે છે. તેની ૫૦ કળીનો ભાવ માંગ અને પૂરવણને આધિન રૂપિયા ૨ થી ૪ જેટલો મળે છે.

## ૬. જ્લેડિયોલસ

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કુ. થુ., જૂનાગઢ)

જ્લેડિયોલસ ઈરીડેસી કૂળના કંદથી થતો છોડ છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને આંધ્રપ્રદેશમાં વાવેતર કરવામાં આવે છે. લાંબી દાંડી, રંગોની વિવિધતા તથા ઘણાં દિવસ સુધી તાજાં રહેતાં કટકલાવર તરીકે જ્લેડિયોલસના ફૂલ ઘણાં જ પ્રખ્યાત છે. આથી જ હોટલો, ઓફિસો, બંગલાઓ વગેરે રોજીંદા ફૂલદાનીની સજાવટમાં તેમજ પાર્ટીઓમાં ફૂલદાનીની સજાવટ, કલગી તેમજ ગુલદસ્તા તરીકે મોટા પ્રમાણમાં વપરાય છે. સામાન્ય રીતે તેના પાન તલવાર જેવા હોવાથી અંગેજુમાં તેને સ્વોડ લીલી પણ કહે છે. તેના ફૂલ ઘણાં દિવસ સુધી ખીલતાં રહેતાં હોવાથી કટકલાવર તેમજ કૂંડાના છોડ, ફૂલની કયારી તથા બોર્ડર તરીકે વાવેતર કરી શકાય છે.

### અગત્યની જાતો

જ્લેડિયોલસની લગભગ ૨૦૦ જાતિઓ છે. જ્લેડિયોલસમાં મોટા ફૂલોવાળી અને નાનાં ફૂલવાળી એમ બે જાતો જોવા મળે છે. તેની વેપારી ધોરણે વાવેતર કરવામાં આવતી મોટાભાગની જાતો હાઈબ્રિડ છે, જે વિવિધ રંગોમાં જોવા મળે છે.

### રંગ પ્રમાણે જાતોનું વર્ગીકરણ

રંગ	જાતો
લાલ	ઓસ્કાર, હન્ટિંગ સોગ, સાન્સ સોસી, ફાન્ટ્ઝિમા, રેડીચ, પ્ર્યુઝીક મેન.
ગુલાબી	અમેરિકન બ્યુટી, ફેન્ઝશીપ, રોઝ સુપ્રિમ, રોઝ સ્પાયર, મીસ સાલેમ, પિંક ફોર્મલ, પિંક ચીયર,
પિંક	પિંક પ્રોસ્પેક્ટર, સ્પીક એન્ડ સ્પાન, સ્પ્રિંગ સોગ.
ઓરેન્જ (નારંગી)	ઓરટમ જ્લો, કોરલ સીઝ, ફીસ્ટા, જુલ્સી ડાન્સર, ઓરેન્જ બ્યુટી.
વાદળી ભૂરો	એનિવર્સરી, બર્ગન્ડી બલ્યુ, ડોન મિસ્ટર, એલિગન્સ પર્પલ જાયન્ટ, પર્પલ મોથ, શાલીમાર,
પાણી	બલ્યુ બર્ડ, ચાયના બલ્યુ, ડ્રોપિક સી, હર મજેસ્ટી.
સફેદ	ગ્રેટન બ્લોઝમ, ફ્રીમ જ્લો. ઈન્સ્ટર્ન સ્ટાર, સુપર સ્ટાર, સેન્સેરે, વ્હાઇટ ઈન્ન્યાન્ડ્રેસ,
લીલો	સ્નો પ્રિન્સેસ, સ્નો ડસ્ટ, સ્નો ડ્રોપ.

- સુગંધિત જાતિ : એસીડેન્થેરા બાયકલર.
- કટકલાવર અને ગાર્ડન ડિસ્પ્લે માટેની જાતો : બ્યાટી સ્પોટ, ચેરી બ્લોઝમ, ફેન્ઝશીપ, જોવેગનર, મેલોડી, સ્નો પ્રિન્સેસ, વોટર મેલોન પિન્ક, વાઈટ રોઝ.
- આઈ.એ.આર.આઈ., નવી દિલ્હી ખાતે વિકસિત થયેલી જાતો : અન્નિરેખા, મયુર, સુચિત્રા.
- એન.બી.આર.આઈ., લખનૌ ખાતે વિકસિત થયેલી જાતો : મનમોહન, મુક્તા, મનિષા, મનહર અને મોહિતી.

- આઈ.આઈ.એચ.આર., બેગલોર ખાતે વિકસિત થયેલી જતો : નજરાના, અંસરા, સપના આરતી, પૂનમ, મીરા અને શોભા.
- સિમલા કેન્દ્ર ખાતે વિકસિત થયેલી મીનીએચર જતો : કેનબેરા, જોલીમેકર, મસોબ્રા, બટરફલાય, સિટાસીનેસ હાઇબ્રીડ અને રેડ કેના.

### સંવર્ધન

સંવર્ધન કંદ અને કંદિકાઓથી થાય છે. ફક્ત સંકર જાત બનાવવા બીજનો ઉપયોગ કરવામાં આવે છે. બીજથી થયેલ છોડમાં બે થી ત્રણ ફૂલ આવે છે.

### હવામાન

આ પાકને ઠંડી અનુકૂળ હોવાથી શિયાળાની ઋતુ દરમ્યાન સારી ગુણવત્તાવાળા ફૂલો મળી શકે. ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડિસેમ્બરના પ્રથમ પખવાડીયા સુધી તેનું વાવેતર થઈ શકે છે. જાન્યુઆરી માસ બાદના વાવેતરમાં ફૂલ આવતી વખતે ઉનાળો શરૂ થઈ જતાં ફૂલની ગુણવત્તા પર હવામાનની વિપરીત અસર થાય છે.

### જમીન અને જમીનની તૈયારી

સારી નિતારશક્તિ હોય તેવી દરેક પ્રકારની જમીનમાં આ પાક થઈ શકે છે. કંદની રોપણી કરતાં પહેલાં ઠંડી એડ કરી નીંદણ નાશ પામે ત્યાં સુધી જમીન તપવા દેવી. ત્યારબાદ સમાર મારી જમીન ભરલરી અને સમતળ કરવી.

### રોપણી પદ્ધતિ

જ્વાલિયોલસનું વાવેતર કંદથી થાય છે. રોપણી માટે ૪ થી ૫ સે.મી. વ્યાસના કંદ પસંદ કરવા. વાવેતર પહેલાં કંદને લેજવાળી જગ્યાએ રાખવાથી સ્કૂરણ જલ્દી થાય છે. કંદની ઉપરનું લાલ પડ તોડીને ૨૪ કલાક પાણીમાં બોલ્યા બાદ સાધારણ સ્કૂરણવાળા કંદનો રોપવા માટે ઉપયોગ કરવો. રોપણી બે હાર વચ્ચે ૩૦ થી ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૫ થી ૨૦ સે.મી. અંતર રાખી પ થી ૭ સે.મી. ઉંડાઈએ કરવી.

### ખાતર વ્યવસ્થા

એન.બી.આર.આઈ., લખનૌના સંશોધન મુજબ હેકટર દીઠ ૨૦ ટન છાણીયું ખાતર આપવું જોઈએ. આ ઉપરાંત અળસિયાનું ખાતર ૫ ટન પ્રતિ હેકટરે આપવું જોઈએ.

### પિયત વ્યવસ્થા

રોપણી બાદ સ્કૂરણ સુધી મર્યાદિત પિયત આપવું. આ પાકને ૮ થી ૧૦ દિવસના ગાળે નિયમિત હલકું પાણી આપવું જરૂરી છે. પરંતુ કચારામાં પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવી.

### નિંદામણ અને આંતરખેડ

જ્વાલિયોલસના મૂળ છીછાં હોવાથી ઠંડી એડ કરવી હિતાવહ નથી પણ વખતોવખત નીંદણ કાઢી જમીન નીંદણમુક્ત રાખવી આવશ્યક છે. આ પાકમાં ભારે ખાતર તથા પિયતની જરૂરિયાત હોવાથી નીંદણનો ભારે ઉગાવો રહે છે. દરેક પિયત બાદ નિંદામણ તથા હાથ કરબડીની હળવી એડ કરવાથી જમીન પોચી બને છે અને નીંદણનો નાશ થાય છે.

### ખાસ માવજત

ફૂલ આવતાં પહેલાં છોડને માટી ચડાવવી જોઈએ તથા જરૂર જણાય તો છોડને ટેકા પણ આપવા જોઈએ.

### પાક સંરક્ષણ

#### રોગ

**સૂક્ષ્મરોગ :** આ રોગ ખૂબ નુકશાનકારક છે. રોગકર્તા ફૂગ મૂળ, કંદ અને પાનના નીચેના ભાગમાં વાહકપેશીની અંદર પ્રવેશી

નિવાસ કરે છે. આ પરિસ્થિતીને લીધે છોડના જમીનની નીચેના ભાગમાં સડો પેદા થાય છે, પાન પીળા પડીને નીચે ઢળી પડે છે. ઘણી વખત ફૂલો સાથેની દાંડી પણ વિકૃતિ પામે છે. ફૂલની સંખ્યા અને કદમાં પણ ફેરફાર થાય છે.

### નિયંત્રણ :

- વાવણી માટે તંદુરસ્ત કંદની પસંદગી કરવી.
- દર ૩ થી ૪ વર્ષે પાકની ફેરબદલી કરવી.
- કંદના સંગ્રહ દરમ્યાન તેમજ વાવેતર સમયે લીમડા આધારિત અર્કનો પટ આપવો જેથી ઉપરોક્ત રોગોથી મુક્તિ મેળવી શકાય.

### જીવાત

આ પાકમાં થ્રિપ્સ જેવી ચૂસિયા પ્રકારની જીવાત જોવા મળે છે, તેના નિયંત્રણ માટે લીંબોળીના મીજનું ૫% (૫૦૦ ગ્રામ/ ૧૦ લીટર પાણી) દ્રાવણનો છંટકાવ કરવો. આ ઉપરાંત લસણ-મરચાંનાં અર્કના ૧૦% દ્રાવણનો પાન પર છંટકાવ કરવો.

### ફૂલો ઉતારવા

ફૂલ દાંડીમાં જયારે નીચેની પ્રથમ કળીઓમાં ફૂલનો રંગ જોવા મળે એટલે કે પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે છોડની નીચેનો ૪ થી ૭ પાન વાળો ભાગ રહેવા દઈ ફૂલદાંડી કાપી લેવી અને પાણી ભરેલ ડોલમાં સત્વરે મૂકી દેવી. ફૂલને ઘણાં દિવસ એક જ ફૂલદાનીમાં રાખવા હોય ત્યારે પાણીમાં રહેલ દાંડીનો થોડો ભાગ રોજ કાપતાં રહેવું. કંદના વાવણીના અંતર પર ફૂલદાંડીના ઉત્પાદનનો આધાર રહે છે.

### ફૂલોનું ઉત્પાદન

૬૦ હજાર કંદ એકરે રોપ્યા હોય તો એકરે ૭૦ થી ૭૫ હજાર ફૂલદાંડી (સ્પાઇક) મળે છે.

### કંદ ખોદવા

ફૂલ દાંડી કાપી દીધા બાદ છોડના પાન પીળા પડવા માંડે એટલે કે આશરે દોઢ થી બે માસ બાદ કંદ ખોદી લેવા. આ કંદને ૧૫ દિવસ છાંયડામાં સૂકવ્યા બાદ જ તેનું ગ્રેડિંગ કરવું. ગ્રેડિયોલસના કંદની જાળવણી ઘણી જ કાળજ માંગી લે છે. કંદને વ્યવસ્થિત સૂકવ્યા બાદ કાણાં પાડેલ પ્લાસ્ટિક બેગમાં અથવા કંતાનના કોથળામાં ભરી ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો. સામાન્ય રીતે કોણ સ્ટોરેજમાં ૪૦ થી ૭૦ ફેરનહીટ ઉષ્ણતામાન અને ૬૦% લેજ સાથે ૪ માસ સુધી કંદનો સંગ્રહ કરવો પડે છે.

### બજાર વ્યવસ્થા

આ ફૂલો હોટલમાં તથા ઘરોમાં ફૂલની સજાવટ માટે તથા બૂકેમાં વપરાતાં હોય તેનું વેચાણ ફક્ત મોટા શહેરોમાં થઈ શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ મુંબઈમાં તેનું માર્કેટ મળી રહે છે. આ ફૂલોનો ભાવ એક ડાનના ૧૨ થી ૧૮ રૂપિયા પ્રમાણે મળી રહે છે.

## ૭. રજનીગંધા (ગુલછડી)

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કૃ. થ્ય., જૂનાગઢ)

ગુલછડી એ કંદ વર્ગનો છોડ છે તેના પાન લાંબા, સાંકડા અને ઘાસ જેવા સીધા હોય છે. ફૂલ નલિકા આકારના, સ્લિંગધ અને રંગ સફેદ હોય છે. ગુલછડીના કંદની ટોચે પાનના ઝૂમખામાંથી નીકળતી ૮૦ થી ૧૦૦ સે.મી. લાંબી દાંડી પર ૬ થી ૭ દિવસ સુધી એક પછી એક સુગંધયુક્ત ફૂલો ખીલતાં રહેતાં હોવાથી તે કટફલાવર તરીકે ખૂબ જ પ્રચલિત છે. છૂટાં ફૂલો વેણી તથા હાર બનાવવાના ઉપયોગમાં આવે છે. છોડ કૂંડામાં કે બાગમાં કયારા, કિનારે રોપવાથી તેની આહલાદ્યક સુગંધ આપે છે. ફૂલમાંથી નીકળતું સુગંધિત તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવે વેચાય છે.

### પ્રસર્જન

ગુલછડીનું પ્રસર્જન કંદથી થાય છે. કયારેક કંદના ભાગથી પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨.૫ થી ૩ સે.મી. વ્યાસવાળા કંદનો ઉપયોગ રોપણી માટે કરવો જોઈએ.

### (ક) સુધારેલ જાતો :

(૧) સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજુ જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે.

(૨) ડબલ : આ જાતમાં ફૂલમાં પાંખડીઓની બે શી ત્રણ હાર હોય છે જેથી ફૂલનું કદ મોટું અને ભરાવદાર લાગે છે. ફૂલની ટોચ પર ગુલાબી રંગના ટપકાં જોવા મળે છે જેથી તેને પર્લ ડબલ કહેવાય છે. ફૂલ રંગે આછા પીળાશ પડતાં હોય છે જેમાં સુગંધનું પ્રમાણ સિંગલ જાત કરતાં ઓછું હોય છે. તેનો ઉપયોગ કટ ફ્લાવર્સ તરીકે થાય છે.

(૩) દ્રિરંગી પર્ણ જાત : આ જાતનાં ફૂલ અને દાંડી સિંગલ ફૂલવાળી જાત જેવા જ હોય છે, પણ તેના પાન પર પીળા રંગની પટ્ટીઓ હોય છે જેથી દેખાવમાં છોડ સુંદર લાગે છે. ફૂલમાં સુગંધનું પ્રમાણ મધ્યમ હોય છે.

### (ખ) હાઈબ્રિડ જાતો :

ગુલછડીના સંશોધનનું કાર્ય લખનૌ તથા બેંગલોર ખાતે કરવામાં આવે છે. એન.બી.આર.આઈ., લખનૌ દ્વારા ૨૪તરેખા અને સુવર્ણરેખા એમ બે જાતો બહાર પાડવામાં આવેલ છે. જયારે આઈ.આઈ.એ.ચ.આર., બેંગલોર દ્વારા સિંગલ પ્રકારમાં શુંગાર અને પ્રજવલ જયારે ડબલ પ્રકારમાં સુવાસિની અને સેમી ડબલ પ્રકારમાં વૈલવ જાત બહાર પાડવામાં આવેલ છે.

### આબોહવા

ગુલછડીની પેતીમાં હવામાન છોડના વિકાસ અને ફૂલના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે. મહત્તમ (૪૦° સે.) અને ન્યુનતમ (૧૦° સે.) તાપમાન ફૂલની દાંડીની લંબાઈ, વજન અને ગુણવત્તામાં ઘટાડો કરે છે. યોગ્યતમ તાપમાન ૨૦° થી ૩૦°સે. છે. ગરમ અને લેજવાળું હવામાન છોડની વૃદ્ધિ માટે અનુકૂળ છે.

### જમીન

આ પાક વિવિધ પ્રકારની જમીનમાં થઈ શકે છે. પરંતુ સારાં નિતારવાળી, વધુ બેજ સંગ્રહક શક્તિવાળી ગોરાડું કે રેતાળ ગોરાડું તેમજ વધુ સેન્ઝિય પદાર્થોવાળી જમીનમાં સારું ઉત્પાદન આપે છે. જમીનનો પી.એ.ચ. આંક ૬.૫ થી ૭.૫ હોવો જોઈએ.

## જમીનની તૈયારી

ગુલછડીનો પાક બે થી ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ રહેતો હોવાથી જમીનની તૈયારી ખાસ જરૂરી છે. તે માટે ડ્રેક્ટરથી ઉંડી એડ કરી, નીંદણ નાશ પામે ત્યાં સુધી જમીન તપવા દેવી. ત્યારબાદ સમાર મારી ઢેંફા ભાંગી ભરભરી જમીન તૈયાર કરવી. સારું કોહવાચેલું ગળતિયું ખાતર હેક્ટરે ૨૦ થી ૩૦ ટન જમીનમાં રોપણીના એક માસ પહેલાં ભેણવલું ત્યારબાદ પિયત આપી યોગ્ય માપના કયારા બનાવી રોપણી કરવી.

## રોપણીની રીત

સારી જાતના કંદ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને એક માસનો આરામ આપ્યા બાદ રોપણી કરવાથી વાનસ્પતિક વૃદ્ધિ તથા ફૂલનું ઉત્પાદન સારું મળે છે. કંદને છૂટાં પાડીને રોપવા આખા જરૂરી રીતે રોપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થશે, જ્યારે ફૂલની દાંડીની ગુણવત્તા ખરાબ થશે. સામાન્ય રીતે ૨ થી ૩ સે.મી. વ્યાસવાળા કંદ રોપણી માટે પસંદ કરવા જોઈએ. કંદનું વજન ૩૦ થી ૬૦ ગ્રામ હોય તો સારું ઉત્પાદન મળે છે, પરંતુ આવા કંદ મળવા મુશ્કેલ છે. રોપણીની ઉંડાઈ ૪ થી ૭ સે.મી. કંદનું કંદ, જમીનનો પ્રકાર અને વિસ્તાર પ્રમાણે રાખવી જોઈએ. સામાન્ય રીતે એપ્રિલ, મે તથા જૂન માસમાં રોપણી કરવી જોઈએ. જ્યારે દક્ષિણા રાજ્યોમાં જુલાઈ-ઓગષ્ટનો સમય સારો માલ્યમ પડયો છે. જો તાપમાન વધુ ઓછું ન હોય તો શિયાળા દરમ્યાન પણ રોપણી કરી શકાય. ૬૨ ત્રણ વર્ષે નવેસરથી રોપણી કરવી જરૂરી છે. પાકની જાત, કંદનું કંદ, પાકની માવજત અને રોપણીની ગીયતા, ફૂલના ઉતાર અને ગુણવત્તા ઉપર અસર કરે છે. બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૩૦ સે.મી. અંતરે રોપણી કરવી જોઈએ. જો પાક એક વર્ષ રાખવાનો હોય તો ૩૦ સે.મી. × ૨૦ સે.મી.ના અંતરે પણ રોપણી કરી વધુ ઉત્પાદન મેળવી શકાય.

## ખાતર

જમીનની તૈયારી વખતે ૨૦ થી ૩૦ ટન/હેક્ટર છાણીયું ખાતર આપવું જોઈએ.

## પિયત

કંદ રોપ્યા બાદ પાણી આપવું, ત્યારબાદ કંદનો ઉગાવો થાય ત્યાં સુધી પિયત આપવું નહિ. વધારે પડતાં ભેજથી કંદ સડી જવાનો ભય રહે છે. પિયતની માત્રા જમીનનો પ્રકાર, છોડની વૃદ્ધિ અને હવામાન પર આધાર રાખે છે. શિયાળામાં ૧૦ થી ૧૫ દિવસે અને ઉનાળામાં ૭ દિવસના અંતરે પાણી આપવું જોઈએ.

## નિંદામણ અને આંતરખેડ

ગુલછડીના મૂળ ધીઇરાં હોવાથી ઉંડી એડ કરવી હિતાવહ નથી પણ વખતોવખત નીંદણ કાઢી જમીન નીંદણમુક્ત રાખવી આવશ્યક છે. ગુલછડીના પાકમાં ભારે ખાતર તથા પિયતની જરૂરિયાત હોવાથી નીંદણનો ભારે ઉગાવો રહે છે. દરેક પિયત બાદ નિંદામણ તથા હાથ કરબક્કિની હળવી એડ કરવાથી જમીન પોચી બને છે અને નીંદણનો નાશ થાય છે.

## ફૂલદાંડીની લણણી

ગુલછડીને કટ ફૂલાવર તરીકે બજારમાં વેચવાની હોય કે તેમાંથી સુંગિત તેલ કાઢવાનું હોય તેની કાપણી યોગ્ય અવસ્થાએ કરવી જરૂરી છે. કટ ફૂલાવર માટે ફૂલદાંડી સાથે સૂર્યોદય પહેલાં કરવી જોઈએ. જ્યારે છૂટાં ફૂલ, હાર બનાવવા કે બીજુ રીતે વપરાશ માટે ખીલેલાં ફૂલ સવારે તોડવા જોઈએ. સુગંધિત તેલ માટે પણ કાપણી વહેલી સવારે કરવી જોઈએ. મોડી કાપણી કરવાથી તેલના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અર્ધ ખીલેલી કળીઓ કરતાં તાજાં ખીલેલાં ફૂલમાં સુગંધિત તેલનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેલ માટે આખી દાંડી ન કાપતાં માત્ર તાજાં ખીલેલાં ફૂલો જ વહેલી સવારે તોડવા જોઈએ. કટ ફૂલાવર માટે પહેલી ફૂલની જોડી ખૂલે ત્યારે ધારદાર ચખ્યુથી દાંડી કાપી પાણીની ડોલમાં મુકવી જોઈએ. દાંડી પર ફૂલ ખીલવવાની શરૂઆત નીચેથી ટોચ તરફ ફૂલ ખીલતાં જાય છે.

## વર્ગીકરણ અને વેચાણ

બજારમાં મોકલતાં પહેલાં ફૂલદાંડીનું વર્ગીકરણ કરવું જોઈએ જેથી સારાં ભાવ મળી રહે. ફૂલની દાંડીનું ગ્રેડિંગ

---

દાંડીની લંબાઈ, ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧૨ દાંડી) નીચેનાં ભાગો ભીના છાપાના કાગળમાં વીટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિસ્યુપેપર કે પોલીથીલીનમાં વીટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલી શકાય છે.

### ફૂલદાંડીનો સંગ્રહ

કટ ફ્લાવર તરીકે ફૂલદાંડીને ઘરની અંદર સુશોભન માટે, લાંબા સમય રાખવા માટે ફ્લાવરવાળમાં ખાંડ (સુકોઝ) ૧ થી ૪% નું દ્રાવણમાં રાખવાથી ૧૦ થી ૧૨ દિવસ સુધી ટકી શકે છે.

### ઉત્પાદન

ફૂલનું ઉત્પાદન પાકની જાતો તથા રોપણી સમયે કંદનું કદ, રોપણીનો સમય તથા રોપણીની ગીયતા અને અન્ય માવજત ઉપર આધાર રાખે છે. રોપણ પાકમાં સરેરાશ ૪.૮ થી ૬.૬ ટન, જ્યારે પ્રથમ લામ પાકમાં ૮.૮ થી ૧૨.૧ ટન અને બીજા લામ પાકમાં ૪.૨ થી ૫.૪ ટન પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે, જ્યારે છૂટાં ફૂલનું ઉત્પાદન રોપણ પાકમાં ૧૫ થી ૨૦ ટન, પ્રથમ લામ પાકમાં ૨૦ થી ૨૫ ટન અને બીજા લામ પાકમાં ૭.૫ થી ૧૦ ટન મળે છે. એક કંદમાંથી એક જ ફૂલદાંડી નીકળે છે, પરંતુ મુખ્ય કંદની આજુબાજુ બાજી કંદ જેમ જેમ પરિપક્વ થતાં જાય તેમ તેમ તેના પર ફૂલદાંડી આવતી જાય છે.

### કંદની લણણી

ગુલાંડાના કંદની લણણી પરિપક્વ થવાની અવસ્થાએ કરવી જોઈએ. ફૂલ ઉતારવાનું બંધ થાય અને છોડની વૃદ્ધિ અટકી જાય ત્યારે લણણી કરવી. આ સમયે પિયત બંધ કરવું અને પાન જમીનની સપાટીએ કાપી નાંખી કંદ બહાર કાઢવા જોઈએ.

### કંદનું ઉત્પાદન

કંદનું ઉત્પાદન જાત, કંદની રોપણી વખતનું કદ અને અન્ય માવજત ઉપર રહે છે. સામાન્ય રીતે ત્રણ વર્ષ બાદ ૨૧.૩ ટન પ્રતિ હેકટર કંદનું ઉત્પાદન મળે છે.

### સંગ્રહ

કંદની આજુ બાજુ વળગેલી માટી દૂર કરી કંદ છૂટાં પાડવા, ફીલા પાન તથા લાંબા મૂળ કાપી કંદનું જુદાં જુદાં કદ પ્રમાણે વર્ગીકરણ કરવું. કંદને ઠંડા, સૂકું અને છાંયડાવાળી જગ્યાએ સંગ્રહ કરવો. રોપણી પહેલાં ૪ થી ૬ અઠવાડિયાનો સંગ્રહ કરવો જરૂરી છે.

### ફૂલોનો બજારભાવ

ગુલાંડાના ફૂલ સિંગલ જાતના કટ ફ્લાવર ૧૦ થી ૧૨ ફૂલ દાંડીની જૂડી બનાવી બજારમાં મોકલાય છે. કેળના પાનમાં વિંટાળીને મોકલવાથી લેજ જળવાય છે. એક જૂડીના રૂપિયા ૬ થી ૧૨ સુધી ભાવ મળે છે. ડબલ જાતના કટ ફ્લાવરનો ભાવ રૂપિયા ૬ થી ૧૮ સુધી મળે છે. ફૂલોને રંગન કરી (લાલ, પીળા, વાદળી વગેરે) વેચવાથી ભાવ સારો મળે છે. તે માટે ફૂલોને ૦.૩% ના મીઠાઈ અથવા આઈસકીમમાં વપરાતાં રંગના પાઉડરના દ્રાવણમાં ૬ થી ૮ કલાક દાંડીને કાચ્યા પછી રાખવાથી રંગન ફૂલોવાળી દાંડી મળે છે.

## ૮. ગોલ્ડન રોડ

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કુ. થ્ય., જૂનાગઢ)

ગોલ્ડન રોડ, સોલિડાગો તરીકે પણ ઓળખાય છે, તે એસ્ટરેસી ફેમિલીમાંથી આવે છે. આ ફૂલ પાક મૂળ ઉત્તર અમેરિકામાંથી ઉદલવિત થયેલ છે. આ ફૂલોનો ઉપયોગ, બગીચામાં બોર્ડર બનાવવા માટે, બેડ બનાવવા અથવા રોડ ગાર્ડનમાં થાય છે. આ ફૂલોનો ઉપયોગ સુશોભન તેમજ કલગી બુકે બનાવવા માટે પણ થાય છે. ગોલ્ડન રોડનાં છોડ ૨૦-૩૦ સે.મી.ની ઉંચાઈ ધરાવે છે તેમજ આછાં લીલાં પાન હોય છે. ગોલ્ડન રોડ પાક ૧૦૦ થી ૧૩૦ દિવસમાં ફૂલો આવવાની શરૂઆત કરે છે, તેને ૫૦-૭૫ સે.મી. લાંબા પેનિકલ હોય છે. ગોલ્ડન રોડનું પ્રસર્જન ગાંઠ અથવા બીજથી થાય છે.

### ગોલ્ડન રોડની જાતો

- બલાર્ડી
- ગોલ્ડનગેટ
- પીટર પાર
- લોકલ

### હવામાન

ગોલ્ડન રોડને સારી વૃદ્ધિ માટે પૂરતાં પ્રમાણમાં પ્રકાશ અને મધ્ય ઉષ્ણતામાન જરૂરી છે. જેથી ગોલ્ડન રોડને ખુલ્લી જગ્યામાં વાવવાથી પૂરતાં પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળવાથી વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.

### જમીન

આ પાકને ગોરાડું, મધ્યમ કાળી અને ફળક્રૂપ સારાં નિતારવાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ચિકણી માટીવાળી કે પાણી ભરાતું હોય તેવી ઓછા નિતારની જમીન અનુકૂળ નથી. જમીનનો પી.એ.ચ. ૬ થી ૭ વધુ માફક આવે છે. વધારે ઉત્પાદન માટે સેન્ટ્રિય ખાતર ઉમેરવું હિતાવહ છે.

### વર્ધન

ગોલ્ડન રોડનું પ્રસર્જન વાનસ્પતિક પદ્ધતિ દ્વારા કરી શકાય છે. જેમાં સામાન્ય રીતે તેનું વર્ધન પીલા અને સ્ટ્રોલ્સથી કરી શકાય. આ પાકના છોડ ઉગાડવા અન્ય ફૂલ પાકોની સરખામણીમાં સહેલા છે. જયારે છોડના મૂળ ગંઠાઈ જાય અને ફૂલ આવવાનું ઓછું થાય ત્યારે છોડના હુંઠા-મૂળીયા (સ્ટ્રોલ્સ) જમીનમાંથી ઉખાડી તેનો વાવેતર માટે ઉપયોગ કરી શકાય.

### રોપણી અંતર

ગોલ્ડન રોડની ૩૦ સે.મી. × ૩૦ સે.મી. તથા ૪૫ સે.મી. × ૨૦ સે.મી.ના અંતરે રોપણી કરવી જોઈએ. ગોલ્ડન રોડનું વાવેતર કોઈપણ ઝતુમાં કરી શકાય છે પરંતુ વસંત ઝતુ (ફ્લૂઆરી-માર્ચ) અને ચોમાસામાં વાવેતર કરવું હિતાવહ છે.

### પિયત

એક હળવું પિયત રોપણી કર્યા બાદ તરતજ આપવું જરૂરી છે. શરૂઆતમાં વાવણી થી એક માસ સુધી અઠવાડિયામાં બે વાર પિયત આપવું. ત્યારબાદ ૭ થી ૮ દિવસનાં અંતરે પિયત આપવા જોઈએ તેમજ ઉનાળામાં ૩ થી ૫ દિવસનાં અંતરે પિયત આપવું જરૂરી છે.

## ખાતર

છોડને સારી ગુણવત્તાવાળા ફૂલો આવે તે માટે 20 ટન સારું કોહવાયેલ છાણીયું ખાતર કે કમ્પોસ્ટ ખાતર પ્રતિ ફેકટર વાવેતર પહેલાં જમીનમાં સારી રીતે લેળવીને આપવું. બાયોફર્મલાયઝર જેવા કે, એગોસ્પિરીલમ અને ફોસ્ફોબેકટર બેકટેરીયા ૧ - ૧.૫ લીટર/ફેકટર નાખવા.

## ઈતર કાર્યો

છોડને હાથથી નીંદણમુક્ત રાખવો અને શરૂઆતની અવસ્થામાં કરબડીથી આંતરખેડ કરવી જોઈએ. શરૂઆતની અવસ્થામાં પાકને નીંદણમુક્ત રાખવાથી મુખ્ય પાક સાથે પોષણ અને પાણી માટે હરીફાઈ કરતા નથી જેથી પાકની વૃધ્ઘા અને વિકાસ સારો થવાથી ફૂલોની ગુણવત્તા સારી મળે છે તેથી બજાર ભાવ અને નફો વધારે મેળવી શકાય છે.

## રોગ અને જીવાત

આ પાકને ખાસ કોઈ રોગ-જીવાત લાગતા નથી. આમ છતાં ધણીવાર મોલો-મશીનો તેમજ અન્ય ચૂસિયાં પ્રકારની જીવાતનો ઉપદ્રવ કયારેક આબોહવાની વિષમ પરિસ્થિતિમાં જોવા મળે, ત્યારે ૫૦૦ ગ્રામ લીંબોળીના અર્કને (૫%) ૧૦ લી. પાણીમાં લેળવી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવો.

## કાપણી

પૂર્ણગુણમાં જયારે ૨૫% જેટલા ફૂલો ખીલે ત્યારે પૂર્ણદંડ વહેલી સવારમાં જમીનથી ૫ થી ૬ સે.મી. રહેવા દઈ સીકેટરની મદદથી કાપી લેવા જોઈએ તેમજ તેમને તરતજ પાણીમાં ફૂલાડી રાખવા જોઈએ. આમ કરવાથી ફૂલોની ગુણવત્તા અથવા તાજગી લાંબો સમય સુધી જળવાય રહે છે જેથી વધારે બજાર ભાવ અને ચોખ્ખો નફો મેળવી શકાય છે. ૧૦ થી ૧૨ પૂર્ણદંડની જુડી બનાવી કાગળ અથવા કેળના પાનમાં વાંટાળી વેચાણ માટે બજારમાં મોકલવા.

## ઉત્પાદન

ગોલ્ડન રોડ પાક પ્રતિ ફેકટર ૩ થી ૪ ટન ઉત્પાદન આપે છે.

## ૬. ગલગોટા

(પ્રાધ્યાપક અને વડા, બાગાયત વિભાગ, જૂ. કુ. થુ., જૂનાગઢ)

ગલગોટા અથવા હજારીગલ તરીકે ઓળખાતા આ કૂલો દેશના ગામડે જાણીતાં છે. ગુલાબને જો કૂલોનો રાજા તરીકે ઓળખવામાં આવે તો ગલગોટાને કૂલોનાં પ્રધાન (વજુર) તરીકે અવશ્ય ઓળખી શકાય. કારણકે, ગલગોટા તેની સરળ એતી પદ્ધતિ, બિજી બિજી જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શક્તિ, કૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉ શક્તિ અને આકર્ષક રંગવાળા કૂલોને લીધે આપણાં દેશમાં સૌથી વધુ લોકપ્રિય અને લોકલોગ્ય બન્યા છે. ગલગોટા તેના નારંગી અને પીળા રંગ પરનાં પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શાણગાર માટે છૂટાં કૂલનાં રૂપમાં તેમજ કૂલોને દાંડી સાથે કાપીને કટફલાવર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેના કૂલોના રંગ, કદ અને આકાર તેમજ છોડનાં કદ અને વિકાસમાં રહેલ વૈવિધ્યતાને લીધે બગીચામાં સુશોભિત કૂલ છોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે.

### જાતો

આપણાં દેશમાં મુખ્ય બે પ્રકારનાં ગલગોટા ઉછેરવામાં આવે છે.

૧. આફિકન મેરીગોલ્ડ: આફિકન મેરીગોલ્ડ કે જે ગલગોટા તરીકે ઓળખાય છે. તેનાં છોડ ૬૦ થી ૮૦ સે.મી. ઉંચા, કૂલ મોટા કદના, પીળા, નારંગી કે લેમન રંગવાળા અને સારી ટકાઉ શક્તિ ધરાવે છે. આ વર્ગમાં તેના કૂલોનાં રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો છે. જેવીકે, જાયન્ટ ડબલ આફિકન ઓરેન્જ, લેમન, કેકર જેક, અલાસ્કા, ફાયર ગ્લોવ, ગોલ્ડન જ્યુબીલી, સનસેટ જાયન્ટ, કાયસેન્ટીમમ ચાર્મ, હનીકોમ્બ, કલાયમેક્સ, સ્પન ગોલ્ડ, સફેદ રંગના કૂલો ધરાવતી જોડીની જાત પણ વિકસાવવામાં આવેલ છે. તાજેતરમાં આઈ.એ.આર.આઈ., નવી દિલ્હીથી બહાર પાડવામાં આવેલ બે હાઈબ્રિડ જાતો પુસા નારંગી અને પુસા બસંતી છે જે ગુજરાતમાં પણ સફળતા પૂર્વક ઉછેરી શકાય છે.

૨. ફેંચ મેરીગોલ્ડ અથવા ગલગોટી: આ જાતના છોડ ટીંગણાં ૨૫ થી ૩૦ સે.મી. ઉંચાઈનાં, કૂલો નાના કદનાં પરંતુ મોટી સંખ્યામાં ખૂબજ વધારે અને પીળા, નારંગી, લાલ, કશ્યાઈ રંગોનાં મિશ્રણવાળા જોવા મળે છે. જેની મુખ્ય જાતોમાં બ્રાઉન સ્કાઉટ, પીગ્મી, બટરસ્કોચ, રસ્ટીરેડ, રોયલ બેંગાલ, મેરી જેનેફલેમ, રોયલ બ્રોકેડ, રેડ બ્રોકેડ, પેટાઈટ્સ વગેરે મુખ્ય છે.

આ ઉપરાંત ગલગોટા અને ગલગોટીનાં સંકરણથી તૈયાર કરેલ અને બંનેનાં ગુણધર્મો ધરાવતી આંતરજાતિય સંકર જાતો જેવી કે રેડ એન્ડ ગોલ્ડ, ન્યોટ, સોબોટ, સેવન સ્ટાર વગેરે વિકસાવવામાં આવી છે.

### આબોહવા

ગલગોટાને આપણાં વિસ્તારની બધા જ પ્રકારની આબોહવા માફક આવતી હોઈ વર્ષની ત્રણેય ઝતુમાં ઉછેરી શકાય છે. છતાં શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને ટ્રાક દિવસનો ખુલ્લો સૂર્યપ્રકાશ કૂલ ઉત્પાદન માટે વધારે સાનુકૂળ માલૂમ પડેલ છે. શિયાળામાં છોડનો વિકાસ ખૂબજ ઓછો પરંતુ ઉત્તમ ગુણવત્તાવાળા (રંગ, કદ અને આકાર) કૂલોનું ઉત્પાદન ખૂબ જ વધારે મળે છે. જચારે ઉનાળા અને ચોમાસામાં ઉંચુ ઉષ્ણતામાન અને લાંબા દિવસને લીધે પૂષ્પકળી લેદીકરણની કિયામાં વિક્ષેપ પડવાથી વાનસ્પતિક વૃદ્ધિ ખૂબ જ વધુ થાય છે. પરિણામે કૂલો ઉત્તરતી કક્ષાનાં અને ખૂબજ ઓછું ઉત્પાદન આપે છે અને છોડ ફળી પડવાની તકલીફ વધારે જોવા મળે છે.

### જમીન અને તેની તૈયારી

ગલગોટાને બધા જ પ્રકારની હલકીશી ભારે કાળી જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. છતાં, ઓછી અપ્લટાવાળી જમીન વધારે માફક આવે છે. ખૂબ જ રેતાળ કે અતિ ભારે કાળી જમીન અનુકૂળ નથી. ગલગોટા (આફિકન મેરીગોલ્ડ)ને ભારે

કાળી જમીન જ્યારે ગલગોટી (ફેન્ચ મેરીગોલ્ડ) ને હલકી જમીનમાં ઉછેરી શકાય છે. આ પાકનાં ધરુની ફેરરોપણી કરતાં પહેલા જમીનને એકાદ-બે વાર ઝેડીને ભરભરી બનાવવી જોઈએ. ફેરરોપણીમાં નડતરરૂપ પદ્ધતિનાં ટ્રકડાં વીણીને દૂર કરવા અને માટીનાં ઢેફાને ભાંગી નાખવા ત્યાર બાદ સમાર ચલાવી જમીન બરાબર સમતળ કરવી.

### વાવણી અને રોપણી

વાવેતર માટે બીજમાંથી ધરુ તૈયાર કરીને ફેરરોપણી કરવામાં આવે છે. છતાં ચોમાસાની ઝતુમાં જૂના છોડનાં કુમળા કટકા વાવીને પણ છોડ તૈયાર કરી શકાય છે પરંતુ આ પદ્ધતિ સામાન્ય રીતે અનુકૂળ નથી. કેમ કે આ રીતે તૈયાર કરેલ છોડ પર ફૂલોની સંખ્યા ઓછી પરંતુ કદમાં મોટા અને ઉત્તમ ગુણવત્તાવાળા ફૂલો મળે છે. જે ખાસ પ્રદર્શન માટે અથવા હરિફાઈ માટે ઉપયોગમાં લેવાય છે. બીજમાંથી ધરુ તૈયાર કરી વર્ષની ત્રણેય ઝતુમાં બીજનું વાવેતર કરી ફેરરોપણી કરવી.

ફૂલો મેળવવાનો સમય	ધરુ તૈયાર કરવાનો સમય	ફેરરોપણીનો સમય
શિયાળો	સપ્ટેમ્બર-ઓક્ટોબર	ઓક્ટોબર-નવેમ્બર
ઉનાળો	જાન્યુઆરી-કેબ્રૂઆરી	કેબ્રૂઆરી-માર્ચ
ચોમાસું	જૂન-જુલાઈ	જુલાઈ-ઓગષ્ટ

ધરુ ઉછેરવા માટે પહોળા-છીછરા કુંડા અથવા ગાદી કયારા તૈયાર કરી તેમાં બીજનું વાવેતર કરવું. એક હેક્ટરના પાકની ફેરરોપણી માટે ૧ થી ૧.૫ કિ.ગ્રા. બીજની જરૂર પડે. ગલગોટાના બીજની જીવન શક્તિ એકાદ વર્ષમાં નાશ પામતી હોઈ દર વર્ષે નવા બીજનો વાવેતર માટે આગ્રહ રાખવો. બીજમાંથી ધરુ તૈયાર થયે ૪૦ થી ૪૫ દિવસે ફેરરોપણી કરવી. ફેરરોપણીનાં અંતરનો આધાર તેની જાત પર હોય છે. ગલગોટાની રોપણી ૪૫ સે.મી. થી ૬૦ સે.મી.નાં અંતરે જ્યારે ગલગોટીના ધરુની રોપણી બે હાર અને બે છોડ વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખી કરવી. ફેરરોપણી કર્યા બાદ ખૂબ જ હળવું પિયત આપવું અથવા બે દિવસ સુધી ફક્ત દરેક છોડને દુવે પાણી આપવું જેથી ફેરરોપણી કરેલ છોડ આડા ન પડે. છોડ બરાબર જમીનમાં સ્થાયી થયા બાદ છૂટું પિયત આપવું. પાકના આખા જીવનકાળ દરમ્યાન ઝતુ અને જમીના પ્રકાર પ્રમાણે ૫ થી ૧૦ દિવસે પિયત આપવાની જરૂર રહે છે. કોઈપણ અવસ્થાએ થોડી પાણીની ખેંચ પણ છોડના વિકાસ અને ઉત્પાદન ઉપર ખરાબ અસર કરે છે.

### ખાતર

જમીનની તૈયારી કરતી વખતે હેક્ટર દીઠ ૧૫ થી ૨૦ ટન કોહવાયેલું છાણીયું ખાતર કે કર્પોરેશન ખાતર ભેળવી જમીનને ઝેડી ભરભરી બનાવવી. લીલા પડવાશ તરીકે શણનું વાવેતર ગલગોટાના વાવેતર પહેલા ૬૦ દિવસે કરવું. એઝોસ્પીરીલમ અને ફોસ્ફેક્ટર બેકેટેરીયા ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં નાખવા. ૫ ટન/ હેક્ટર વર્મિકર્પોરેશન ગલગોટાના વાવેતર સમયે તથા ત્રીજા, ચોથા અને પાંચમાં મહિને આપવું.

### અંતરખેડ અને નિંદામણ

આ પાકના શરૂઆતના વૃદ્ધિકાળ દરમ્યાન અંતરખેડ કરી શકાય છે. પરંતુ છોડને નુકશાન ન થાય તે ખાસ જોવું. છોડનો ફેલાવો થયા પછી અંતરખેડ કરવી યોગ્ય નથી. ધરુની ફેરરોપણી કર્યા બાદ વારંવાર નીંદણ કાઢવું ખાસ જરૂરી છે. જેથી બે-ત્રાણ પિયત બાદ કોદાળીથી હળવો ગોડ કરી ખુરપી વડે બધુંજ નીંદણ દૂર કરવું. જીવનકાળ દરમ્યાન ૩ થી ૪ વખત નિંદામણ કરવાની જરૂર રહે છે.

### પાક સંરક્ષણ

ગલગોટાના પાકમાં વિશેષ પ્રમાણમાં ખાસ રોગ-જીવત જોવા મળતા નથી. પરંતુ ધરુવાડીયામાં ધરુનો કોહવારો અને કોલર રોટ નામના રોગની શક્યતા વધારે રહે છે. છોડની ફેરરોપણી કર્યા પછી પાન પર ટપકાં, ભૂકી છારો, પાન અને ફૂલનો સૂકારો જેવાં રોગની શક્યતા રહે છે. આ પાક પર જીવતોમાં લીફમાઇનોરનો ઉપદ્રવ ખાસ જોવા મળે છે. વળી કયારેક રૂવાટીવાળી ઈયળ અને લીલી ઈયળનો ઉપદ્રવ ફૂલને નુકશાન કરે છે.

- વાવેતર સમયે લીમડા આધરિત અક્ષનો પટ આપવો જેથી ઉપરોક્ત રોગોથી મુક્તિ મેળવી શકાય.
- કાયસોપાના ઈંડા ૧૦૦૦૦ની સંખ્યામાં ઉપદ્રવને ધ્યાને રાખીને બે વખત છોડવા.
- બીવેરીયા ફૂગ હું ગ્રામ/૧૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવો.
- ચીકટાને આશ્રય આપતાં નીંદણોનો નાશ કરવો.
- સફેદ માખી માટે પીળા સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરવો.
- ગલગોટાના મૂળ અને થડનો કોહવારો ધરુવાઈયામાંથી પણ શરૂ થઈ શકતો હોય અને ભેજના વધુ પડતાં પ્રમાણથી રોગની શક્યતા વધતી હોય ધરુવાડિયું બનાવવા હુમેશા સારાં નિતારવાળી, ઉંચી જગ્યાએ ગાઢી કથારા બનાવવા જેથી પાણીનો નિતાર અને નિકાલ થઈ શકે.
- ધરુવાડિયું બનાવવાની જગ્યાએ સ્ક્રાચેલાં જડિયાં, ઘાસ અને પાન બાળી જમીનનું નિર્જીવીકરણ કરવું જેથી જમીનના ઉપરના ભાગમાં રહેલ રોગપ્રેરક ફૂગનો નાશ કરી શકાય.
- ધરુવાઈયામાંથી રોગીઓ છોડને ઉપાડી બાળી નાખવા. ધરુવાઈયામાંથી ફેરરોપણી માટે તંદુરસ્ત રોપાઓનો જ ઉપયોગ કરવો.
- ગોકળગાયવાળા વિસ્તારમાં શેઢાપાળા સાફ રાખવા તેમજ વીણીને તેનો નાશ કરવો.
- ગલગોટાની ફેરરોપણી પહેલાં છાણિયા ખાતર/વર્માઇમપોસ્ટ કે કમ્પોસ્ટ સાથે ટ્રાયકોડર્મા વીરીડી, સ્યુડોમોનાઝ ફ્લોરેસન્સના કલ્યર ભેટવી તેને ૭ થી ૧૦ દિવસ રાખી દરેક છોડના ખામણે વાવતાં પહેલાં આપવાથી થડ અને મૂળના કોહવારની ફૂગનું જોવિક નિયંત્રણ મળી રહે છે.
- ૧.૫% ગૌમુત્ર + ૧.૫% છાસ + ૦.૫% ગોળનો રોપણીના ૩, ૬ અને ૮ મહિના બાદ છંટકાવ કરવો.

### ખાસ માવજત

ગલગોટાના પાકને ટેકા આપવા અને ફૂલકળી ચુંટવી (પીંચીંગ) જેવી ખાસ માવજતની જરૂર પડે છે.

(અ) ટેકા આપવા: ગલગોટાની ઉંચી વધતી જાતોનો વિકાસ થતાં છોડ ફળી ન પડે માટે ફૂલો બેસતાં પહેલાં છોડના થડમાં માટી ચઢાવવી તેમજ દરેક છોડના થડ પાસે પાતળી લાકડી જમીનમાં ખોસીને ઢીલી દોરીથી એક થી બે જગ્યાએ લાકડી સાથે બાંધી ટેકો આપવાથી છોડ ફળી પડતા નથી. જેથી ફૂલોની ગુણવત્તા બગડતી અટકાવી શકાય છે.

(બ) ફૂલકળી ચુંટવી (પીંચીંગ): ગલગોટાની આફીકન જાતોમાં આ માવજત ફાયદાકારક માલ્યમ પડી છે. છોડની ફેરરોપણી બાદ ૩૫ થી ૪૦ દિવસે છોડની અગ્રકલીકા દૂર કરવી જેથી કક્ષકલીકાઓમાંથી નવી ડાળીઓ જૂસાલેર ફૂટે, છોડનો ફેલાવો સારો થાય અને સારી ગુણવત્તાવાળા વધુ ફૂલો મળે.

### ફૂલો ઉતારવા

ગલગોટાના ફૂલો છોડ પર પૂરેપૂરા ખીલ્યા પછી જ ઉતારવા જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે પરંતુ ઠંડા પહોરમાં કરવું હિતાવહ છે. ફૂલો વિણવાના આગલા દિવસે પિયત આપવાથી ફૂલોની ટકાઉ શક્તિ વધે છે. છૂટાં ફૂલો હાથથી સહેલાઈથી ચુંટી શકાય છે. છૂટાં ફૂલોને ઉતાર્યા બાદ પ્લાસ્ટિક બેગ અથવા વાંસના ટોપલામાં ભરીને બજારે મોકલવા જોઈએ. છોડ ઉપરથી નિયમિત ફૂલો ચુંટવાથી છોડની ઉત્પાદન ક્ષમતા વધે છે. ગલગોટાના ફૂલોને સામાન્ય રીતે ચુંટતી વખતે જ અલગ અલગ રંગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. તદુપરાંત તેના કદ અને જાત પ્રમાણે પણ અલગ રાખી શકાય. સીંગાલ ફૂલ અને ગુચ્છાદાર (દબલ) ફૂલોને અલગ અલગ ચુંટી વર્ગીકરણ કરવાથી ભાવો સારા મળે છે. છૂટાં ફૂલોને ઉતાર્યા બાદ તૂરત જ બજારે મોકલવા જોઈએ. બજાર દૂર હોય તો વાંસના ટોપલાને પાણીમાં પલાણેલ મસલીન કાપડમાં ફૂલોને મૂકી, ટોપલો ભીના કાપડથી બંધ કરવો. ત્યાર બાદ બજારમાં મોકલવાથી ફૂલોની ગુણવત્તા સારી રહે છે અને યોગ્ય ભાવ મળી રહે છે.

## કૂલોનું ઉત્પાદન

આફિકન અને ફેન્ય મેરીગોલ્ડમાં ઉત્પાદનનો આધાર તેની જાત, ઝતુ, વાવેતર પદ્ધતિ, રોપણી અંતર અને ખાતર-પાણીની માવજત ઉપર આધાર રાખે છે. છતાં સામાન્ય સંજોગોમાં આફિકન મેરીગોલ (ગલગોટા)નું ઉત્પાદન ૮ થી ૧૦ ટન પ્રતિ હેક્ટર અને ફેન્ય મેરીગોલ (ગલગોટી)નું ઉત્પાદન ૧૧ થી ૧૮ ટન પ્રતિ હેક્ટર લઈ શકાય છે.

## બીજ ઉત્પાદન

ગલગોટા એ વારંવાર પરપરાગીત (ઓફન કોસ પોલીનેટેડ) પાક હોઈ જે તે જાતનું શુદ્ધ બીજ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. શુદ્ધ બીજ મેળવવા સારાં છોડના કૂલોને ખીલતાં પહેલાં કાગળની કોથળીથી બંધ કરવા અથવા આવા છોડને પરપરાગનથન રોકવા મસલીન કાપડનો તંબુ બનાવી આખો છોડ ઢાંકવો. ત્યાર બાદ જે તે અલગ રાખેલ કૂલના બીજ બરાબર પાકે ત્યારે જ એકત્ર કરવા જોઈએ. ગલગોટાના બીજ ઉત્પાદનમાં બીજો પ્રશ્ન નરવંધ્યતાનો છે. ડબલ ગુચ્છાદાર કૂલો મોટે ભાગે નરવંધ્ય હોય છે. જેથી તેમાં સ્વપરાગનથન શક્ય બનતું નથી. આવા કૂલોને તેની જ જાતના અન્ય અર્ધ ગુચ્છાદાર કૂલો કે જેમાં નર પરાગરજ બનતી હોય તેની પરાગરજ એકઠી કરી ગુચ્છાદાર નરવંધ્ય અથવા કુદરતી રીતે મળેલ નરવંધ્ય જાતનો ઉપયોગ માદા લાઈન તરીકે કરવામાં આવે છે. આ રીતે ખાસ કાળજી રાખી સારી ગુણવત્તાવાળા કૂલોમાંથી બીજ ઉત્પાદન મેળવતાં હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ કિ.ગ્રા. જેટલું બિયારણ મળી શકે છે.